https://archive.org/details/bk203/page/n0/mode/1up

1932-05-14 to 22 -KKP Gnati Sudharak Yuvak Mandal -Report (203)

All items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

॥ उमा देव्याः ॐ कृपास्तु ॥

કરાચીમાં સ્થપાયેલ

શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળના

કામકાજનો

રીપોર્ટ.

કરેજા કાર્ય ત્હારૂં તું, જરૂર તે તો સફળ થાશે;
ફળે જો ના હયાતીમાં, ફળો તુજ છોકરા ખાશે.
મળે જયમાળ નહિ તોએ, કર્યું તે વ્યર્થ ન જાશે;
કર્યાનું દામ મેળવશે, ધર્યો જા ભાઇ ઉલ્લાશે.

ઇ૦ સ૦ ૧૯૩૨.
વિક્રમ સં. ૧૯૮૮.

છપાવી પ્રસિદ્ધ કરનાર :—
રતનસી શીવજી પટેલ,
સેક્રેટરી,
શ્રીકચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળ.
ગાર્ડન ક્વાર્ટર, શ્રીચંદ વિશનદાસ રોડ, કરાચી.

realpatidar.com

https://archive.org/details/bk203/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 21, 22, 24, 25, 26.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v5.py

https://archive.org/details/bk203/page/n2/mode/1up

1932-05-14 to 22 -KKP Gnati Sudharak Yuvak Mandal -Report (203)

Real Patidar
Unravel Truth

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.16 16:23:36 +05'30'

realpatidar.com

॥ उमा देव्याः ॐ कृपास्तु ॥

કરાચીમાં સ્થપાયેલ

શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળના

કામકાજનો

રી પો ર્ટ.

કરેજા કાર્ય ત્હારૂં તું, જરૂર તે તો સફળ થાશે;
ફળે જો ના હયાતીમાં, ફળો તુજ છોકરા ખાશે.
મળે જયમાળ નહિ તોએ, કર્યું તે વ્યર્થ ન જાશે;
કર્યાનું દામ મેળવશે, ધર્યો જા ભાઈ ઉલ્લાશે.

ઈ૦ સ૦ ૧૯૩૨.
વિક્રમ સં. ૧૯૮૮.

છપાવી પ્રસિદ્ધ કરનાર :—
રતનસી શીવજી પટેલ,
સેક્રેટરી,
શ્રીકચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળ.
ગાર્ડન ક્વાર્ટર, શ્રીચંદ વિશનદાસ રોડ, કરાચી.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

realpatidar.com

realpatidar.com

realpatidar.com

નિવેદન.

સૈકાઓ થયાં આપણી જ્ઞાતિ પીરાણાપંથના અજ્ઞાન કુંડમાં ડુબકાંઓ ખાતી હતી, પણ જ્યારથી કરાચીમાં **યુવક મંડળની** સ્થાપના થઇ ત્યારથી પ્રતિદિન સ્વજ્ઞાતિમાં સુધારાનો સૂર્ય પ્રકાશવા લાગ્યો. તે પ્રકાશના કિરણોમા રા. રા. ભાઇશ્રી **નારાયણજીભાઈ** ના પ્રયાસથી રા. **રાજાભાઈ સામજી** ના પ્રમુખપદે પરિષદ આરંભાઇ સુધારાના ઠરાવો પસાર કરી, સ્વજ્ઞાતિ ભાઇઓમાંથી અજ્ઞાનતા દુર કરી સત્ય સનાતન પવિત્ર વેદધર્મના બીજ રોપાવા શરૂ થવા લાગ્યા. તેમજ યુવકોના કાર્યથી પરિષદના મહોત્સવે અત્યંત દબદબાથી તેમજ જોરશોરથી સુધારાના ઠરાવોને મજબૂત કર્યા.

જે જોતાં રાત્રી મટી જેમ સુર્યોદય થતાં નિસાચરો તેમજ ઘુવડો ગુફાઓ શોધવા નિકળી પડે છે, તેમજ પીરાણાપંથના ઇજારદારો કાકા તેમજ સૈયદો, કચ્છના ગઢેડાઓનું શરણ લેવા મંડી પડયા. જ્ઞાતિના થાંભલારૂપી આગેવાનો સુધારાના મંડળો જોઈ મુંઝાણા અને હવે શું કરવું આભ તુટયો ત્યાં થીગડાં કેમ દેવાય. બાપ ગઢેરો તો દીકરો મંડળનો કાર્યવાહક, બાપ હડાહડ પીરાણાનો મુખી તો બેટો સુધારાનો જબર સાથી, જ્યાં જુઓ ત્યાં દરેક કુટુંબમાં મોટો ભાઇ જબર મુખી અથવા પીરાણાનો ઉપદેશક હોય તો, નાના ભાઇ પીરાણાનો કટર વિરોધી હોય આવી સ્થિતી આખી જ્ઞાતિમાં ઠે ઠેર થઇ પડતાં દરેક માબાપો પોતાના દિકરાઓને અટકમાં અથવા ઘરમાં ગોંધી રાખવા લાગ્યા, પણ હમેશાં સત્યતાનું કાર્ય આગળ ધપતું જાય છે. એ સુત્રાનુસાર જ્ઞાતિમાં દિવસાનુદિવસ સુધારાનો પ્રવાહ જોશભેરથી આગળ વધવા લાગ્યો. કેટલાંએ માબાપો પોતાના પુત્રોને યજ્ઞોપવિત ધારણ કરતા જોઇ, તેઓની જનોઇને બળાત્કારે નાદિરશાહી સત્તા વાપરી તોડવા લાગ્યા. તેમજ કેટલાક તો પોતાના પુત્રોને મંડળવાળાને ત્યાં જમતા જોઇ મારપીટ કરી દુઃખો દેવા લાગ્યા. પોતાનો પુત્ર હો કે પુત્રી હો ભાઇ હો કે બેન હો, જમાઇ હો કે બીજા અન્યત્ર સગું હો તે જુલમથી કદાચ એકાદ વખત દબાશે પણ જેઓના હૃદયમાં સુધારાનું બીજ રોપાઇ ગયું છે, તે હૃદયમાંથી કાઢવાને માટે પીરાણામાં એવી કોઇ શકિતી કે તદબીર નથી કે એ બીજને છીન્ન ભીન્ન કરી શકે.

Situation in families where members were on different religious paths

મંડળનું કાર્ય પૂરજોશમાં કરાચી, મુંબઇ–ઘાટકોપર, કચ્છમાં વીરાણી, દયાપુર વિગેરે ગામોમા ચાલતું હતું તે જોરદાર અરસામાં કરાચીના મંડળના ઉપ–પ્રમુખ **ભાઇ ખેતા ડાંસા** પોકારતું અકાળે અવસાન થયું. જેથી મંડળના કામકાજમાં અમુક અંશે, ફરક પડવા લાગ્યો, અને ગતીમંદ પડવા લાગી, પરંતુ તરતજ મુંબઇ–ઘાટકોપરમાં પરિષદની ત્રીજી બેઠક ભરાણી જેથી મંડળમાં પુનઃ જાગ્રતી આવી. ત્યાંતો સૈન્યનો સરદાર પડી જતાં જેમ સૈન્યમાં ભંગાણ પડે છે, તેમ કરાચીના મંડળના માજી પ્રમુખ **નાનજી પચાણ** એકાએક આ ફાની દુનિયાનો ત્યાગ કરી, ઇશ્વરના શરણે જવા માટે પ્રયાણ કર્યું જેથી કરાચીમાં સુધારાનો બાગ માળી વિના છીન્ન ભીન્ન અવસ્થામાં આવી પડયો. તે જોઇ મંડળના ભાઇઓએ વિચાર કરી રા. રા. ભાઇશ્રી **નારાયણજીભાઇ** ને તેડાવ્યા, તે આવવાથી મંડળના ભાઇઓમાં પુનઃ કામ કરવાની હિંમત આવી તેથી કેટલાએક ભાઇઓએ દેહ શુધ્ધિ કરાવી, અને પુનઃ મંડળની સ્થાપના કરી.

જે અમુક દિવસ ચાલ્યું ત્યાં તો કોટડાના કણબી નાનજી માવજીની સ્ત્રી લક્ષ્મીબાઇના સંબંધમાં તકરાર થઇ (જેનો ખુલાસો રીપોર્ટમાં છે) તેથી મંડળમાં મોટે પાયે ફાટફુટ પડી, અને

realpatidar.com

https://archive.org/details/bk203/page/n5/mode/1up

1932-05-14 to 22 -KKP Gnati Sudharak Yuvak Mandal -Report (203)

realpatidar.com

લગભગ પાંચ વરસથી કાર્ય તદન બંધ પડયું, જેથી સુધારાની ધગસવાળા ભાઇઓ રા. રા. **નારાયણજીભાઈ** ને તેડાવવાનો વિચાર કરતા હતા ત્યાંતો તેઓજ તેમના ભત્રીજા ભાઇશ્રી જીવરાજ વાલજીના લગ્ન નિમિતે ચાલુ વરસના વૈસાખ માસમાં આવ્યા. તેજ દિવસથી દરેકના હૃદયના વિચાર સમજીને તેમની ભુલ કબુલ કરાવીને તા. ૧૪ મી મે ના રોજ સભા ભરવી નકકી કરી. તે મુજબ તા. ૧૪-૫-૩૨ને શનીવારની રાત્રે:સભા ભરી, ત્યાં સૌ ભાઇઓ આવ્યા એક-મેકના હૃદયની આપલે કરી, જુના પાંચ વરસના હિસાબ ચોખા કર્યા, અને સુધારાની પુનઃસ્થાપના થઇ તે જોઇ સર્વના રદયમાં આનંદ થયો.

હવેથી પરમાત્મા મંડળના મેમ્બરોમાં સંપથી કાર્ય કરવાની બુધ્ધિ અર્પે અને રા. રા. **નારાયણજીભાઈ** ને ઇશ્વર દિર્ઘાયુષ આપે કે જેથી અમારી જ્ઞાતિ પીરાણાપંથમાંથી મુકિત મેળવે એજ જગતનિયંતા પ્રત્યે પ્રાર્થના છે. અસ્તુ.

લી. જ્ઞાતિસેવક,
રતનસી શીવજી પટેલ,
કચ્છ રવાપુરવાળા.

ખુશ ખબર! ખુશ ખબર!!

Stopped since 8 years i.e., from around 1924 →

છેલ્લા આઠ વરસથી બંધ પડેલ

"પાટીદાર ઉદય"

માસિકને ફેર સજીવન બનાવવાની ઇચ્છા ધરાવતા ભાઇઓએ પોતા તરફથી જેટલી બની શકે તેટલી આર્થિક મદદ મોકલાવવી તેમજ દરેક જ્ઞાતિ ભાઇ-ઓએ પોતાનું નામ ગ્રાહક તરીકે નોંધાવવું. જો મદદ મળશે અને ૫૦૦ (પાંચસો) ગ્રાહકો પોતાનાં નામ નોંધાવશે તો તુરતમાંજ અમારા તરફથી તેને સજીવન કરવામાં આવશે. માટે જ્ઞાતિ પ્રત્યે ખરી દાઝ ધરાવનાર બંધુઓએ પોતાના નામ તથા ઠેકાણું અમોને નીચેના સીરનામે લખી મોકલવાની કૃપા કરવી.

રતનસી શીવજી પટેલ,
ઠે૦ શ્રીચંદ વિશનદાસ રોડ, ગાર્ડન કવાર્ટર,
નશરવાનજીની મીલની બાજુમાં, કરાચી.

realpatidar.com

https://archive.org/details/bk203/page/n6/mode/1up

realpatidar.com

ૐ

કરાચીમાં સ્થપાએલ

શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળની

જાહેર સભા.

ગયા મે માસની તા. ૧૪ મી ને શનીવારની રાત્રે સાડાનવ વાગે શેઠ **હરચંદરાય** **બ્રધર્સ**ના ગુદામવાળા મોટા કંપાનમાં **કચ્છી પાટીદાર** ભાઈઓની એક સભા સુધારક યુવક મંડળના મેમ્બર ભાઇ વીશ્રામ પાંચા ગાંગાણી ગામ શ્રી વીરાણીવાલાના **પ્રમુખ**પણા નીચે ભેગી મળી હતી. પ્રથમ શરૂઆતમાં કેટલાક ભાઇઓ સુધારાની કવીતાઓ બોલ્યા પછી ભાઇ લાલજી દાના પાંચાણી નખત્રાણાવાલાએ સંગીતના સાધનો સાથે શ્રી કુળદેવી ઉમીયા-માતાની સ્તુતિ કર્યા બાદ યુવક મંડળના સેક્રેટરી ભાઇ **રતનસી શીવજી નાકરાણી** ગામ શ્રીરવાપુરવાળાએ એ દિવસની સભા બોલાવવાનું કારણ રજુ કરતા જણાવ્યુ હતું કેઃ—

પ્રિય ભાઈઓ! આજે આપણી જ્ઞાતીના આદ્ય સુધારક. આપણ સુધારકના શીર-છત્ર. અને પીરાણા સતપંથ જેવા અર્ધદગ્ધ પાખંડી પંથની પોલો હિન્દુજનતા સમક્ષ ખુલી કરી એ **અર્ધદગ્ધ પંથમાં** ફસાઇ પડેલી આપણી ભોળી જ્ઞાતિને ઉગારનાર આપણા મુરબ્બી પુજ્ય ભાઇશ્રી નારાયણજી ભાઇ તથા તેમની સાથે પધારેલ આપણા સુધારક ભાઇઓનો સતકાર કરવા, તેમજ અત્રેની આપણાં ભાઇઓની સ્થિતીથી તેઓશ્રીને વાકેફ કરવા તેમજ તેમની પાસેથી આપણી જ્ઞાતીના હિત સંબંધીના કાંઇક નવા સમાચારો જાણવા આજની આ સભા બોલાવવામાં આવેલ છે.

ઉપર મુજબનું સંબોધન કર્યા બાદ યુવક મંડળના સેક્રેટરી ભાઇ રતનસી શીવજીએ તાળીઓના ગડગડાટ વચ્ચે રા. રા. ભાઇશ્રી **નારાયણજી રામજીભાઈ** તથા **ગઢુલીના પટેલ પરબત ખીમા** સાખલા ને હાર–તોરા પહેરાવ્યા હતા.

ત્યારબાદ વધુ વિવેચનદ્વારા તેમણે જણાવ્યું કે રા. રા **નારાયણજીભાઇ** ને તો તમે બધા ભાઇઓ તેમજ બહેનોને ઓળખાવવા તે સુરજને બતાવવા જેવું છે કારણ કે તેઓશ્રી આ ચોથી વખતે કરાચીમાં આવેલા છે. તે નહિ પણ તેઓશ્રી આજે ૩૦ વરસથી આપણી જ્ઞાતિની સેવા કરી રહ્યા છે જેથી આપણા કચ્છમાં વસતા ગામે ગામના દરેક જ્ઞાતી-

realpatidar.com

https://archive.org/details/bk203/page/n7/mode/1up

realpatidar.com

ભાઇઓમાં તેઓનું નામ મશહુર છે. એટલુંજ નહી પણ ગુજરાત, કાઠીયાવાડ, નિમાડ, માળવા, ખાનદેશ વગેરે દેશવાસી આપણી પાટીદાર જ્ઞાતીમાં પણ તેને સર્વ ભાઇઓ ઓળખે છે આપણી **જ્ઞાતીના યુવક મંડળો** તેમજ આપણી જ્ઞાતિની **પરીષદો** પણ એ ભાઇશ્રીના અથાગ પરીશ્રમથીજ ઉભી થઇ છે. એ વાત તમો સૌ ભાઇઓ જાણોજ છો. આપને હું યાદ દેવરાવીશ કે જ્ઞાતી સુધારાની હિલચાલ ચલાવવાની હિંમત આપણામાં આવી તે પણ તેઓ ભાઇશ્રીના સહવાસથી જ આવી છે. જે હિંમતથીજ કરાચીમાં વસતા આપણા સર્વ ભાઇઓ મગરૂરી ધરાવીએ છીએ. પણ મને ખરૂં કહેવા દેશો કે આ મગરૂરી થવાનો પ્રસંગ ભાઇશ્રી નારાયણજીભાઇના પ્રયાસનુંજ ફળ છે. એ ભાઇની પ્રથમ મુલાકાત વખતે આપણે તેઓશ્રીની સાથે વાતચીત કરવામાં પણ ડરતા હતા કારણકે તે વખતે આપણા ઉપર આપણી જ્ઞાતિના ગેઢેરાનો ભય અને ત્રાસ બહુજ હતો, તેની બીકને લઇને આપણે બીલકુલ ડરપોક બની ગયા હતા, પરંતુ એ સર્વ ભીરૂતાને ડરપોકપણું આપણામાંથી કાઢી આપણને ખરા સુધારક બનાવનાર પણ એજ બંધુ છે.

એટલુંજ નહિ પણ **પીરાણા સતપંથ** જેવા **પાખંડી પંથ** એટલે કે **ન હિન્દુ તેમજ ન મુસલમાન** એવા અર્ધદગ્ધ પંથની ફાંસાજાળમાંથી આપણને છોડાવી એ પાપી પંથ ને માર્ગે જતાં અટકાવી શુધ્ધ સનાતન વેદિક ધર્મને રસ્તે ફરીથી ચડાવનાર પણ એજ બંધુ છે.

આગળ બોલતાં ભાઇ **રતનસી શીવજી**એ જણાવ્યું કે આપણી જ્ઞાતિમાં મુળ ઘાલી બેઠેલા પીરાણા પંથના લીધે કેટલાક નાના સડાઓ—કુરીવાજોને દુર કરવા મુરબ્બીશ્રી **નારાયણજીભાઇએ** જે જે તનતોડ મહેનતો અને જુએશ ઉઠાવી છે તેનો બદલો તો આપણાથી વાળી શકાય તેમ નથી જ. એમની આપણા પ્રત્યે અને આપણી જ્ઞાતિ પ્રત્યેનો પુજ્યભાવ અને કરેલી અમુલ્ય સેવાનો સરવાળો કે ગણત્રી આપણથી તો કરી શકાય તેમ નથી જ.

Infights

બંધુઓ ! આજે કેટલાએ દિવસથી આપણામાં કુસંપ પડયો છે જેને કાઢવાને માટે આપણામાંહેના કેટલાક ભાઇઓએ મહેનત કરેલી છતાં પણ તેઓ ફળીભૂત થયા નહિ, તેનું પણ એ મુરબ્બીશ્રી જરૂરથી નીરાકરણ કરશે, અને આપણને પોતપોતાની ભુલો સમજાવશે એવી હું ભાઇશ્રી **નારાયણજીભાઇને** પ્રાથના કરૂં છું.

ત્યારબાદ ભાઇ **લાલજી સોમજી નાકરાણી** ગામ રવાપુરવાલાએ જણાવ્યું કે આજે મને ઘણો આનંદ થાય છે કે આપણા શીરછત્ર ભાઈ શ્રી નારાયણજીભાઇ તથા કેટલાક બહાર-ગામના આપણા સુધારક બન્ધુઓ આ સભામાં હાજર છે. ભાઇઓ હું તમોને એક વાત પુછુંછું કે આ જગતમાં કુસંપથી કોણ સુખી થયું છે? કુસંપથી પાંડવો પોતપોતામાં લડયા, કુસંપથી યાદવોનો નાશ થયો તેજ કુસંપથી હાલમાં આપણીજ પાયમાલી થઇ રહી છે તે તમો નજરો નજર જોઇ રહ્યા છો. છતાંપણ તેનો છેડો હજી સુધી લાવતા નથી તે ખરેખર દિલગીર થવા જેવું છે. હવે મને આશા છે કે તમો ભાઇઓ પોતાથી તો તમારા જગડાનો અંત ન આવ્યો પણ આ આવેલ તકને ગુમાવતા નહિ. આ જગડાનો નિવેડો લાવવા જરૂરથી નારાયણજીભાઇને વિનંતી કરશો તો મને આશા છે કે તે ભાઇશ્રી જરૂરથી એ વિનંતીને ધ્યાનમાં લઇ આપણા જગડાનો અંત આણશે.

realpatidar.com

realpatidar.com

ભાઈઓ હું તમોને વધારે કહું તે કરતાં તમો પોતેજ સમજો છો કે આજ છ છ વરસથી આપણે સુધારાનું કયું કામ કરી શકયા છીએ ? કુસંપથી આપણા શુદ્ધિ કરાવેલા ભાઇઓએ આત્મબળના અભાવે પીછેહઠ કરી છે અને નવા સુધારકોનો પણ આપણે આપણામાં વધારો કરી શકયા નથી તે પણ ઘણુંજ અફસોસ થવા જેવું છે. માટે હું તો તમોને વારંવાર એજ વિનંતી કરૂં છું કે જેમ બને તેમ તમો જલદીથી પોતામાં સંપ કરશો અને આ પાપી પંથમાંથી આપણા જ્ઞાતિ ભાઇઓને સત્વર છોડાવશો એટલું બોલી બેસી જવાની રજા લઉ છું.

ત્યારબાદ ભાઇશ્રી શીવજી કાનજી પારસીયા ગામ નખત્રાણાવાલાએ જણાવ્યું કે :—

મહેરબાન પ્રમુખ સાહેબ, વહાલા જ્ઞાતિબંધુઓ અને બહેનો.

મારાથી પહેલાં સેક્રટરી ભાઇશ્રી **રતનસી શીવજી** તેમજ ભાઇશ્રી **લાલજી સોમજી** કહી ગયા કે કુસંપને દુર કરો, કુસંપને દુર કરો. પણ ભાઇઓ આપણામાં કુસંપ થવાનું શું કારણ છે એનું સ્પષ્ટિકરણ ન કરવાથી બહાર ગામથી આવેલા ભાઇઓને કેમ ખબર પડશે કે કુસંપ શા કારણથી થયો તેનું સ્પષ્ટિકરણ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થવાથી મારે કહેવું જોઇએ કે આપણે જયારે સલાહ સંપ કરવા ભેગા મળ્યા છીએ ત્યારે કુસંપનું મુળ શોધવામાં ન આવે ત્યાં સુધી નીવેડો આવેજ નહિ.

ભાઇશ્રી લાલજી સોમજીએ પોતાના ભાષણમાં કહ્યું કે આપણામાં કુસંપ થવાનું કારણ એ છે કે આપણાં મંડળના ભાઇઓ શુધ્ધિ કરાવીને આત્મબળના અભાવે પીછેહઠ કરીને બેસી રહ્યા ને શુધ્ધિના કાર્યમાં વિરોધ કરતા હતા જેથી અંતરાય પડતો ગયો અને મંડળ આજે આ હાલતમાં પહોંચ્યું. આ પ્રમાણે ભાઇશ્રી લાલજી સોમજીએ ઉદ્‌ગારો કાઢયા. અને તેવા ઉદ્‌ગારોથી જે સાચી વાત જનસમાજ સમક્ષ રજુ કરવી હતી તે થઇ શકી નહિ ને ઉલટી રીતે બોલવાથી મારે કહેવું પડે છે કે ભાઇ લાલજી સોમજી જે આક્ષેપ મુકે છે તે બીલકુલ ગેરવ્યાજબી છે.

જયારે કરાચીમાં આપણે શરૂઆતમાં મંડળ કર્યું તેથી આગળ પીરાણાના કાકાને નોટીસો આપનાર તેમજ તેમની સામે સવાલ જવાબ કરનાર કોણ હતા ? મંડળતો ત્યારબાદ થયું, તો તે વખતે આત્મ બળ હતું કે નહિ તેનો વિચાર કરવો જોઇતો હતો.

આપણે ગેઢેરા સામે લડત ઉપાડી, સભાઓ ભરી, સુધારકો કહેવાણા તેમજ પરિષદો ભરીને ઠરાવો ઘડીને આપણા ભાષણોના રીપોર્ટો છપાવ્યા, ને તેમાં આપણે સુધારક તરીકે જાહેર થયા. ને આપણે ગેઢેરાઓનાં નીચ કર્મ ખુલ્લાં કર્યાં તેમજ પીરાણાની પોલ પણ ખુલી કરી ત્યારે જુલ્મી આગેવાનોથી ડરતા નહોતા તેનું કારણ કે આપણામાં સંગઠન હતું કે જેના લીધે કચ્છમાં આપણા મંડળની સારી છાપ પડતી હતી.

આપણે બીજાની ભુલ જોતા હતા પણ પોતાની ભુલ તપાસીને સુધારવાની પણ જરૂર હતી અને છે. આપણાજ મંડળના ભાઇઓમાંથી કોઇ ભાઇ નાલાયકપણે વર્તતો હોય તો તેને સાચું કહેવાનું આપણામાં આત્મબળ કયાં હતું—કયાં છે.

6 years of inactivity - means Narayan Ramji Team's work is stopped in 1926

Reasons for infights

Real Reason, even today

rea

https://archive.org/details/bk203/page/n9/mode/1up

realpatidar.com

આપણે સુધારક કહેવાણા ને આપણું મંડળ હતું, જેથી બીજા ભાઇઓ આપણે આશરે આવ્યા તેનેજ આપણે દગો દીધો. "રક્ષક મટી ભક્ષક" બન્યા. આપણા મંડળના ભાઇ નાનજી માવજી લીંબાણી ગામ કોટડા જડોધરવાલોના ઘરમાં વિગાણીના કણબી ભીમજી લધા ગોગારીની દીકરી લક્ષ્મિબાઇ હતી. તે ભાઇ નાનજી પોતાની સ્ત્રી સહીત આપણે આસરે આવ્યો હતો. તે ભીમજી લધા પોતાની દીકરીને શરજોરીથી નાનજી માવજીના ઘરેથી લઇ ગયો ને તે ભીમજીની મદદમાં આપણા મંડળના કેટલાક ભાઇઓ હતા તે ભાઇઓનો ચોક્કસ ઇરાદો હતો કે તે બાઇ લક્ષ્મિબાઇને તેના ધણીને ન અપાવતાં કરાચીની બીજી પરિષદના પ્રમુખ માવજી પુંજા જણુવાણી ગામ નખત્રાણાવાલા જે સીંધ-હેદ્રાબાદમાં રહે છે તે બધુ તે સમયે વિધુર હોવાથી તેને આપવી એવી અંદરખાનેથી સલાહ હોવાથી મજકુર લક્ષ્મિબાઇને તેના ભાઇ દેવજી ભીમજી સાથે કરાચાથી છુપી રીતે હેદ્રાબાદ રવાના કરી દીધી. મંડળના અમુક આગેવાન ભાઇઓની સહાયતાથી હેદ્રાબાદમાં મજકુર લક્ષ્મિબાઇ જે કરાચી મુકામે મળેલી બીજી પરિષદના પ્રમુખ તેમજ એક વખતના સુધારક માવજી પુંજા જણુવાણી નખત્રાણાવાલાના ઘરમાં જ્ઞાતિના કાયદા વિરૂદ્ધ બેઠી. અને તે સુધારક ભાઇએ કાંઇપણ વિચાર કર્યા સિવાય એટલે વગર વિચાર્યે તે મજકુર બાઇને પોતાના ઘરમાં જ્ઞાતીના કાયદા વીરૂધ્ધ તેમજ સુધારકને શરમાવે તેવી અણછાજતી રીતે બેસારી. તેને આપણા મંડળમાંથી કોઇપણ ભાઇએ કાંઇપણ કહ્યું નહિ એટલે કે મંડળે, એ ભીમજી લધા તથા તેના મદદગારોને તેમજ માવજી પુંજાને રૂબરૂમાં અથવા જાહેરમાં પેપરોદ્વારા કાંઇપણ ન કહ્યું. અમુક વ્યકિતઓ જે પહેલેથીજ તેવા કામથી વિરૂધ હતી તેવાઓના ઉપરે પોતાનો કાણુ મેળવવા માટે પંચ ભેગો કરીને બીજે દિવસે ભીમજીએ ખોટેખોટો કેસ કર્યો ત્યારથીજ મંડળમાંથી સંપ તુટી ગયો અને પક્ષ પડી ગયાં મંડળમાં આગેવાન ગણાતા માણસ અમુક સત્તાના મદમાં અંધ બની મંડળને આશરે આવેલ ભાઇના સ્ત્રીને ભગાડવામાં મદદ કરે તેવા ભાઇઓની શેહમાં તણાઇને કરેલા ઠરાવ ઉપર પાણી ફેરવીને નીચું જોવરાવનાર માણસોને સહાય કરવી ને સુધારકનો ડોળ કરીને તેવાઓને સહાયતા કરવી તે ખરેખર ઘણુંજ શરમાવા જેવું છે ને શરમાવવું જોઇએ. આપણો કોણ વિશ્વાસ કરે જીવતે ધણીએ વિના કારણે વિના સમજુતીએ બીજાના ઘરમાં બેસારી દેવરાવનારાઓ ખરેખર આપણે કચ્છના આગેવાન ગઢેરાથી કોઇ પણ રીતે ઉતરતા નથી એ દીવા જેવું ચોકખું દેખાય છે. માટે પોતાની કરેલી ભુલનું ખરા હૃદયથી પ્રાયશ્ચિત કરીને સત્યના રસ્તે ચાલવા બનતું કરવું જોઇએ, અને પીરાણા પંથી ભાઇઓને બતાવી આપવું જોઇએ કે અમે સાચા સુધારક છીએ. તેમજ આપણી જ્ઞાતિની અંદર ઘુસી ગયેલ **પીરાણા સતપંથ જે ન હીન્દુ તેમજ નહિ મુસલમાન એવા અર્ધ-દગ્ધ** પંથને કાઢવા શકિતમાન થઇ શકીયે. આટલું બોલી મારૂં બોલવું પુરૂં કરૂં છું અને વધારે પડતું તેમજ કોઇને માઠું લાગે તેવું બોલાઈ જવાયું હોય અગર ભુલ થઇ ગઇ હોય તો દરગુજર કરશો આટલું બોલી બેસી જવાની રજા લઉ છું.

તે પછી શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક સંઘના સેક્રટરી ભાઇ રામજી ધનજી નાકરાણી કોટડાવાલાએ ઉભા થઇ સભાને ઉદ્દેશીને જણાવ્યું કે :—

realpatidar.com

https://archive.org/details/bk203/page/n10/mode/1up

realpatidar.com

માન્યવર સભાપતિ પ્રિય જ્ઞાતિ ભાઇઓ અને અન્ય સદગ્રહસ્થો.,

ભાઇશ્રી **શીવજી કાનજી** કહી ગયા કે મંડળના આગેવાનોએ પક્ષપાત રાખવાથીજ આ મંડળમાં કુસંપ થઇ ગયો તેમજ છીન્નભીન્ન થઇ ગયા તેથીજ મંડળનું સુધારાનું કામ અટકી ગયું.

તે સબંધમાં ભાઇઓ મારે જરૂરથી સત્ય કહેવું જોઇએ કે મંડળના આગેવાનો તે કોણ! કદાચ મંડળના મેમ્બરો તેમજ કાર્યકરતા આગેવાનોમાંથી અપવાદ રૂપે એકાદ બે વ્યકિતએ ભાઇશ્રી **નાનજી માવજી**ની પતિન **લક્ષ્મીબાઇ**ને ભગાડવામાં સહાયતા કરી હોય તો તેથી મંડળનું સુધારાનું કામ અટકી જાય એમ માનવુંજ ભુલ ભરેલું છે. કારણ કે મંડળના **અડતાલીશ મેમ્બરો** અને તેમાંથી તેર મેમ્બરો **વ્યવસ્થાપક કમીટીના** હતા. તેમજ **પ્રમુખ સેક્રેટરી** અને **ખજાનચી** જેવા જવાબદાર કાર્યકર્તા ભાઇઓ પણ હતા. તો પછી તેમાંથી ભાગ્યેજ કોઇકજ ભાઇએ નાલાયક કામમાં મદદ કરી હોય તો બાકીના ભાઇઓએ તો સુધારાનું કામ ચાલુ રાખવું જરૂરનું હતું. **મંડળના પ્રમુખ શ્રી મુળજી ડોસા પોકાર મંડળના સેક્રેટરી ભાઇશ્રી રતનસી શીવજી** તેમજ વ્યવસ્થાપક મંડળના મેમ્બરોમાંના **એક ભાઇશ્રી શીવજી કાનજી એમ** ત્રણ વ્યકિતએ ખંત રાખી ઉત્સાહથી કામ કર્યું હોત; તેમજ મંડળના મેમ્બરોમાં ઉત્સાહ પ્રેરવા સાચા દિલથી કમર કસી બનતું કર્યું હોત તો મારી ખાત્રી હતી અને છે કે મંડળની વર્તમાન સમયમાં જેવી કફોડી સ્થિતિ જોઇએ છીએ તેવી સ્થિતિ નીહાળવાનો સમય ભાગ્યેજ પ્રાપ્ત થયો હોત. જ્યારે પોતેજ કંઇ ન કરતાં બીજાનોજ વાંક કાઢીએ તો પછી કોને કહેવાપણું રહે. પણ એતો પત્યું થવાનું હતું તે થઇ ગયું, ગઇ ગુજરી ભુલી જવી જોઇએ અને હવેથી મંડળમાં એકત્તા કરી સંપ સલાહથી રચનાત્મક કાર્યક્રમ ઘડી સુધારાનું કામ આગળ ધપાવવા બનતું કરવું જોઇએ અને તે મુજબ થશેજ એમ હું માનું છું કારણકે સર્વ ભાઇઓના હૃદયમાં **એમ થઇ ગયું** છે કે કોઇ પણ ઉપાયે મંડળમાં સંપ થવોજ જોઇએ તેમજ શીવજી ભાઇએ કહ્યું છે તેવા પક્ષપાત કરવાવાળા કે જેઓનો નાનજી માવજીની સ્ત્રીને ભગાડવામાં હાથ હતો અને તેવાઓનો પક્ષ કરવાવાળા ભાઇઓના દિલમાં પણ પોતાના કૃત્યને માટે પસ્તાવો થાય છે, એવું હાલના વાતાવરણ ઉપરથી સ્પષ્ટ જણાઇ આવે છે. જેથી એમ માનવાને કારણો મળે છે કે સંપ જરૂરથી થશેજ.

ભાઇઓ બીજાને દોષ દેવા કરતાં પોતેજ બેપરવાઈ રાખી છે એવું કબુલ કરવું તેના જેવું એકે સત્ય નથી એમ હું માનું છું. મને પણ આટલા દિવસ સુધી જુદીજ સંસ્થાના નામથી કામ કરવું પડયું તે પણ ખાસ તમારીજ સુસ્તી તેમજ બેપરવાઇથીજ. પછી કેટલું અને કેવી રીતે કામ થયું તે તો બુધ્ધિ તેમજ શક્તિની વાત છે. પણ એકજ સંસ્થાથી કામ કરવામાં આવે તો અલબત તે કામ પ્રસંશનીય ગણાય. મંડળનું કામ સંપ સલાહથી તેમજ ઉત્સાહથી આગળ ને આગળ વધ્યું જતું હોય તો આજે જે જે જુદાઇ દેખાઇ રહી છે તે નજ દેખાત. પ્રભુ સર્વ ભાઈઓને સદ્‌બુધ્ધિ આપે કે જેથી આપે આપણી જ્ઞાતિની અંદર પીરાણા–**સત પંથ જે કે ન હીંદુ તેમજ ન મુસલમાન** એવા **અર્ધદગ્ધ પંથનું નીકંદન** આપણી જ્ઞાતિના આદ્ય સુધારક શ્રીયુત **નારાયણજીભાઈ**ની યોગ્ય સલાહ તેમજ સમજાવટથી કરી શકીયે તેમજ બીજા કેટલાક સુધારાનું કામ આગળ ધપાવી શકીએ એજ વિનંતી.

realpatidar.com

https://archive.org/details/bk203/page/n11/mode/1up

realpatidar.com

ત્યારબાદ રા. રા. નારાયણજીભાઇએ વળતો જવાબ આપવા ઉભા થતાં સર્વ ભાઇઓએ તેમજ બહેનોએ તાળીઓના ગડગડાટથી અને કુળદેવી શ્રીઉમીયામાતાની જય ગર્જનાથી વધાવી લીધા હતા. પોતાનું ભાષણ શરૂ કરતા જણાવ્યું કે:—

તમો કરાચીવાસી ભાઇઓએ આજે જે માનથી મારૂં અને બીજા ભાઇઓનું સ્વાગત કર્યું છે, તેવા માટે હું અમો બધાઓના તરફથી તમો સર્વનો ઉપકાર માનું છું ભાઇ રતનસી શીવજીએ મારા માટે જે જે માનના શબ્દો વાપર્યા છે તે મારા માટે અતિશયોક્તી ભરેલા અને હદ ઓળંગી જનારા ગણાય. એવા માનમરતબાને હું હજુ લાયક નથી, હું તો એક જ્ઞાતિસેવક છું. જ્ઞાતિ સેવા એ મહારૂં મુખ્ય ધ્યેય છે. સેવકને માનકે પ્રતિષ્ઠાની દરકાર નજ હોય. આજે જે શબ્દો બોલી મારૂં માન વધાર્યું છે તેજ પ્રમાણે મેં ઘણા ભાઇઓના મોઢાથી જ્ઞાતિનું અહીત કરનાર તેમજ જ્ઞાતિનું સત્યાનાશ કાઢનાર એવાંપણ કેટલાંક વિશેષણો સાંભળ્યાં છે. મને તો એવાં માન કે અપમાનથી જરા પણ હર્ષ કે શોક થતો નથી આપણ બધાઓના માથે જ્ઞાતિનું રૂણ છે તેમાંથી મેં કવચીતજ પાઇ કે પઇસા જેટલું રૂણ અદા કર્યું હશે. પરંતુ એટલાથી મારે એમ નથી સમજવાનું કે હું એ રૂણમાંથી મુક્ત થયો છું. તેવીજ રીતે તમો સર્વ ભાઇ બહેનોના શિરપર એ રૂણ તો છે જ. એવો વિચાર મનુષ્ય તરીકે તમારે પોતાની બુધ્ધિથીજ કરવાનો છે.

ભાઇઓ હું આથી આગળ ત્રણ વખત આવી ગયો છું પણ મને જ્યારે અત્રે આવું છું ત્યારે લાગી આવે છે કે હજી આપણી જ્ઞાતિના પ્રારબ્ધમાં ફેર છે. કારણ કે હજીસુધી આપણ કાર્યકર્તાઓમાં જોઇએ તેટલો સંપ સલાહ અને કાર્ય કરવાની લાયકાત આવી નથી. હું જરૂરથી માનું છું કે હજી મારા પુરૂષાર્થમાં ખામી છે. તે ન હોય તો આજે ત્રણ ત્રણ વખત તમોને સમજાવ્યા છતાં અત્યારે હું જોઉં છું તો તમો ત્યાંજ પાછા ઉભા છો.

ભાઇઓ! હું જ્યારે ૧૯૨૬ની સાલમાં આવ્યો હતો ત્યારે પણ તમારામાં એજ અદેખાઇ અને કુસંપ હતો. તેજ સ્થિતી આજે પણ જોવામાં આવે છે. તો કહો ભાઇઓ મારી ભૂલ થાય છે કે હું આવું છું ત્યારે તમો એક બીજાને હલકા ઉંચા ગણવા મંડી પડો છો જેથી મતભેદ ઉભો થાય છે તેથીજ વારે ઘડીયે આ સ્થિતી આવે છે તમો મંડળના કાર્યકર્તા ભાઇઓ તમારા પોતાના વચનની, પતિજ્ઞાની કીંમતને સમજી શકતા નથી તેથીજ વારે ઘડીએ તમે પોતાના આપેલા વચનને કોરે મુકીને પાછા વઢવાં મંડી પડો છો.

હમણાં કેટલાક વખતથી તમો યુવક મંડળના ભાઇઓ અને દેહ શુધ્ધિ કરાવેલા ભાઇઓમાં કટલીક બાબતોએ મતભેદ પડયો છે. તે તમારા જેવા ડાહ્યા અને સમજુ ભાઇઓને ન ઘટે. મતભેદ તો થાય એ શકય છે પરંતુ તેથી કાર્ય સીધ્ધિને નુકશાન થતું હોય તો તે આપણાથી કેમ સહ્યું જાય?

જે વખતે આપણે સઘળા ભાઇઓ એક સાથે મળી ધર્મયુધ્ધમાં કેશરીઆ કરી બહાર પડયા છીએ તો પછી તે વખતે માંહોમાહેના મતભેદોને લઇને કલેહ કરીએ તો આપણે ધારેલું કાર્ય સિધ્ધ થઇ શકે નહિ, અને પીરાણા સતપંથના પાખંડ રૂપી વજ્રમય કીલ્લાને તેમજ આપણી જ્ઞાતિના કેટલાક ગુમાની ગેઢેરાઓ કે જેઓ પોતાના તુચ્છ સ્વાર્થમાં અંધ બની જ્ઞાતિની પાયમાલી કરી રહ્યા છે તેમને પણ આપણે પરાસ્ત કરી શકીયે નહી. એટલુંજ નહિ

realpatidar.com

https://archive.org/details/bk203/page/n12/mode/1up

realpatidar.com

પણ આપણા ગરીબ ભાઇઓ તેમજ બ્હેનોને પણ આપણે સ્વતંત્રતા અપાવી શકીયે નહિ માટે મ્હારીતો એ સલાહ છે કે તમે સર્વ ખાસ ધ્યાનપુર્વક વિચાર કરી તમારા હૃદયમાં જે કાંઇ દ્રેશનો ઝરો હોય તે કાઢી નાખી વળી પાછા એક સંપ થઇ સુધારાના કાર્યને આગળ ધપાવવા કમર કસશો એવી મ્હારી પ્રાર્થના છે.

ત્યારબાદ ઉપસંહાર કરતાં પ્રમુખશ્રી વિશ્રામ પાંચા ગાંગાણીએ જણાવ્યું કેઃ—

આજની મીટીંગમાં ઘણીજ અગત્યની વાટાઘાટ થઇ છે આપણામાં કુસંપ થવાનું કારણ ભાઇશ્રી લાલજી સોમજીએ કહ્યું કે આપણા મંડળના ભાઇઓએ શુધ્ધિ કરાવી આત્મબળના અભાવે પીછેહઠ કરી બેસી રહ્યા, તેમજ શુધ્ધિના વિરૂધ્ધ કામ કરવા લાગ્યા. જેથી દિવસા દિવસ રોષ ભરાતો ગયો. ને કુસંપ વધતો ગયો જેના લીધે આપણા મંડળની આજે આ હાલત થઇ છે. મારા મત પ્રમાણે તે ખરૂ જોતાં સત્યથી વેગળું છે [redacted] ભાઇ શીવજીએ કહ્યું તે વાત સત્ય છે હવે આજે આપણે ખુલ્લા હૃદયથી જે વાતો કરી છે તેથી ઉમેદ છે કે આપણામાં સંપ જરૂરથી થશેજ. આપ સર્વ ભાઇઓને મારી નમ્ર વિનંતી છે કે દરેક ભાઇએ પોતાના હૃદયમાંથી રોષ કાઢી નાખીને પોતપોતાની ભુલ સમજીને શુભનિષ્ટાથી તેમજ સર્વે ભાઇઓની મદદથી પડી ભાંગેલું સુધારાનું કામ ફરીથી શરૂ કરી દઇએ. જેથી આપણી કરેલી મહેનત સફળ થાય. આજની મીટીંગનું કામ લગભગ પુરૂં થવા આવ્યું છે. અને ટાઇમ પણ વધારે થઇ ગયો છે તોપણ વિષય અગત્યનો હોવાથી કોઇ પણ ભાઇને આજ વિષય ઉપરે બોલવું હોય તો તેવા ભાઇઓને બોલવાની છુટ છે. (તે વખતે ભાઇશ્રી શીવજી કાનજી પારસીઆ ફરીથી બોલવા ઉભા થયા હતા તેનો સારાંશ તેઓશ્રીના ભાષણમાં આવી ગયેલ છે)

ત્યારબાદ સભા વિસર્જન કરવામાં આવી હતી

તા. ૧૫–૫–૧૯૩૨ ના દિવસની કાર્યવાહી

તા. ૧૪ ને શનીવારના સભાથી કેટલાક ભાઇઓમાં જરૂરથી સંપ કરવાની ઘણી તાલાવેલી જાગી હતી જેથી તા. ૧૫ ની રાત્રે ભાઇશ્રી **નારાયણ શીવજી** ના ઘરે જ્યાં રા. **નારાયણજીભાઇ** ઉતર્યા હતા ત્યાં કરાચી યુવક મંડળના મુખ્ય કાર્યકર્તાઓની એક ખાનગી મીટીંગ બોલાવવામાં આવી હતી ત્યાં આગળ દરેક ભાઇએ પોતપોતાના વિચારો અને તેમાં પડતા મતભેદો રા. નારાયણજીભાઇને કહી સંભળાવ્યા હતા. જે ઉપરથી **નારાયણજીભાઇએ** એક બીજામાં પડતા મતભેદો દુર કરવા દરેકને પોતાની ભુલ કબુલ કરવા તેમજ જ્ઞાતિ હિતના કાર્યમાં હરકત ન આવે એ ઉદ્દેશ ધ્યાનમાં રાખવા દરેક ભાઇઓને પુરતી સમજુતી આપી હતી અને તેવણના વિચારોને દરેક ભાઇઓએ કબુલ રાખ્યા હતા.

દરેક ભાઇઓને ઉદ્દેશીને **નારાયણજીભાઇએ** કહ્યું કેઃ—

ભાઇઓ આપણે-આપણી **પરિષદોએતો** છુટાછેડા **ન** કરવાનો ઠરાવ પાસ કર્યો છે છતાં પણ મે સાંભળ્યું છે કે કરાચીમાં **સુધારાવાળા** ભાઇમાં એક ભાઇની બાયડી બીજો ભાઇ લઇ જાય અને તેમાં ખાસ કાર્યકરતા સુધારકોજ જો સહાય કરે તો તે ઘણુંજ અફસોસ કરવા જેવું છે.

realpatidar.com

https://archive.org/details/bk203/page/n13/mode/1up

realpatidar.com

ભાઇઓ! હવેથી પોતપોતાની ભુલો દરેક ભાઇએ કબુલ કરીને તેનુ પ્રાયશ્ચિત કરો કે જેથી આપણું સુધારાનું કામ આગળ ચાલે. આવું નારાયણજી ભાઇનું કહેવું સાંભળીને ભાઇશ્રી **અબજી મનજી** સેગાણી ગામ નખત્રાણાવાલાએ કહ્યું કે:—

મારી ભુલ થઇ ગઇ છે તે હવેથી તમને યોગ્ય લાગે તેમ કરો મેં પોતેજ ખીમજી શીવજી તે શરણે રાખી વાત પકડાવી હતી. અને તે મુજબજ આજ દિવસ સુધી હું પણ તે વાતને વળગી રહ્યો હતો. કેટલાક દિવસથી મને મારી ભૂલ સમજાણી હતી. જેથી મેં પોતે પણ સંપ કરવા વિષે કેટલાક ભાઈઓને બહુજ સમજાવ્યા છતાં પણ તેઓએ બીલકુલ માન્યું નહિ. છેવટમાં મેં એમ પણ કહ્યું કે ભાઇઓ મારી ભુલ થઇ હોય અને તમને તેમ જણાતું હોયતો તે વિષે મને મારી આપો આવું આવું કહેવા છતાં પણ સાંભળેજ કોણ? કેટલાક ભાઇઓને તો એવો વટ ચડી ગયો હતો કે કોઇ પણ રીતે ભેગા થવુંજ નથી. ઉંહુનું ઓસડ ન હોય તે તો તમો પોતે પણ સમજો છો. જેથીજ આ સુધારાનું કામ અટકી પડયું છે. હવેથી તમે ગમે તેમ કરીને અમને બધાઓને સંતોષ થાય તેવું કરી જાઓ.

એ પ્રમાણે ભાઇશ્રી **અબજી મનજી** તેમજ બીજા કેટલાએક ભાઇઓએ પોતાના વિચારો જણાવ્યા બાદ **નારાયણજીભાઇએ** બધાને કહ્યું કે તમે સર્વે ભાઇઓ કહોછો કે સંપ થવોજ જોઇએ તેમજ સુધારાનું કામ આગળ ધપવુંજ જોઇએ મને એમ લાગે છે કે તમારામાં જે વટ હતો તે નીકળી ગયો છે અને **પાંસરા દોર** થઇ ગયા છો તો હવે એકત્તા કરવામાં વિલંબ નહિ લાગે અને ઇશ્વર સૌ સારૂં કરશે. ત્યારબાદ મોડી રાત્રે સૌ ભાઇઓ પોત પોતાને ઠેકાણે-ઘરે ગયા.

તા. ૧૬-૫-૧૯૩૨ ના દિવસની કાર્યવાહી

શ્રી કચ્છ **કડવા** પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળની એક સભા તા. ૧૬-૫-૩૨ ની રાત્રે સાડા નવ વાગે તા. ૧૪ ને શનીવારે રાત્રે જે સ્થળે સભા મળી હતી તેજ ઠેકાણે એટલે શેઠ હરચંદરાય બ્રધર્સના ગુદામવારા મોટા કંપાનમાં મળી હતી. યુવક મંડળના સેક્રેટરી **ભાઈ રતનસી શીવજીએ** તે વખતની સભા બોલાવવાનું કારણ રજુ કરતાં જણાવ્યું કે :—

ગઇ કાલની ખાનગી ચર્ચા દરમ્યાન કેટલીક બાબતોનો લગભગ અંત આવી ગયો છે. મંડળમાં કુસંપ પડી ગયામાં જે જે ભાઇઓ કારણભુત હોય અથવા જે ભાઇઓને એમ લાગતું હોય કે અમે ખીમજીનો પક્ષ ખાસ ઇરાદાપૂર્વક અથવા અમુક કારણવસાત કર્યો હતો અને તેથીજ પક્ષ થઇ જવાથી સુધારાનું કામ પડી ભાંગ્યું છે, એવું સમજનાર ભાઇઓએ પોતપોતાની ભુલ કબુલ કરી પશ્ચાતાપરૂપી પ્રાયશ્ચીત કરવું અને આપણી સર્વની સંમતીથી ચુંટી કાઢવામાં આવે તે પ્રમુખશ્રી જે ફેંસલો આપે તે માન્ય કરવો.

આજની સભાનો વિષય અતિ મહત્વનો હોવાથી આજની સભામાં લાયક, ડાહ્યા, બુધ્ધિશાળી તેમજ દીર્ઘદ્રષ્ટિવાળા ઠરેલ મગજના પ્રમુખ હોવા જોઇએ. તે માટે ખરૂં જોતાં આપણા સદ્ભાગ્યે ભાઇશ્રી **નારાયણજી રામજી** ભાઇ જેવા આપણી જ્ઞાતિના ઉધારક વીર બંધુ આપણી સમક્ષ હાજર હોવાથી તેવા મુરબ્બી ભાઇશ્રી નારાયણજીભાઇની પ્રમુખ તરીકેની

realpatidar.com

https://archive.org/details/bk203/page/n14/mode/1up

realpatidar.com

દરખાસ્ત મુકુંછું તેને આપ સર્વ ભાઇઓ એકમતે સંમતી આપશો એવી મારી આશા છે.

ઉપલી દરખાસ્તને ભાઇશ્રી **લાલજી સોમજી** નાકરાણી, **રામજી ધનજી** નાકરાણી તેમજ **શીવજી** લધા નખત્રાણાવાલાએ ટેકો આપ્યો હતો અને ત્યારબાદ શરૂઆતમાં રા. **નારાયણજીભાઈએ** પ્રમુખપદ સ્વીકારતાં તે દિવસની સભાનો આભાર માનતાં કહ્યુ કે :—

તમોએ આજની સભાના કામકાજ માટે મારામાં શ્રધ્ધા તેમજ વિશ્વાસ રાખી મને પ્રમુખપદ આપી જે માન આપ્યું છે તેના માટે હું તમો સર્વનો ઉપકાર માનું છું. પણ સાથે સાથે એ પણ કહીશકે મને છુટો રાખ્યો હોતતો અલબત હું કેટલીક બાબતમાં છુટથી બોલી તેમજ **સમજાવી** શકત.

ત્યારબાદ **સભાને ઉદ્દેશી પ્રમુખશ્રી નારાયણજીભાઈએ** જણાવ્યું કે :–

કેટલાંક વરસોથી મંડળમાં પક્ષ પડી જવાથી શુધ્ધિવાળા ભાઇઓમાં કેટલાક ભાઇઓની શુધ્ધિ કાયમ રહી છે કે નહિ? તેવી શંકા ઉપસ્થીત થઇ હોવાથી શુધ્ધિવાળા ભાઇઓને પુછું છું અને ખાનગી ચર્ચા દરમ્યાન પણ જણાયું છે કે ખીમજી શીવજીનો પક્ષ કરનાર **અબજી મનજી** તેમજ **દાના કરશન** અને **રતનસી વીરજી** ઉપરે શંકા છે કે તેઓની શુધ્ધિ બરાબર રહી છે કે નહિ ?

મુળ કારણ અહીંના **ભાઇઓને** પુછતાં એમ જણાય છે કે ગામ કોટડાના કણબી નાનજી માવજી લીંબાણીની ઘરવાલીને **તેમનો** સસરો ભીમજી મજકુર નાનજી ને ઘેર મુકતો નહોતો જેના સબંધમાં પંચ ભેગો થઇને તે વાતની ચર્ચા ચલાવતો હતો તે વખતે વિના કારણે ખીમજી ત્યાંથી કેટલાક શબ્દો કહીને ઉઠી ગયો અને બીજે દિવસે પંચના પાંચ **ભાઇઓ** ઉપરે ફોજદારી **મુકર્દમો** માંડયો (જેના પાછળથી રાજીનામાં થયલાં) તે **ભાઇની** પક્ષ કરનાર ભાઇઓ **માતાજીના** પાટ આગળ આવી પ્રતીજ્ઞાપુર્વક સત્ય હકીકત જણાવી ને કહે કે અમારી શુધ્ધિ બરાબર રહી છે. કે જેથી બાકીના ભાઇઓને વહેમ હોય તે ટળી જાય.

પ્રથમ ભાઇશ્રી **અબજી મનજી** સેંગાણી ગામ નખત્રાણાવાલાએ કહ્યું કે હું પ્રતિજ્ઞા-પુર્વક કહું છું કે મેં પીરાણાપંથી ભાઇઓ તેમજ મંડળવાલા કે જેઓએ શુધ્ધિ નથી કરાવી તેવા ભાઇઓ સાથે મ્હેં કદી પણ ભોજન વ્યવહાર કર્યો નથી, એટલે કે મેં શુધ્ધિનું બરાબર પાલન કર્યું છે.

ત્યારબાદ ભાઇશ્રી **દાના કરસન** પાંચાણી નખત્રાણાવાલાએ કહ્યું કે હું પ્રતિજ્ઞા-પુર્વક કહું છું કે શુધ્ધિના સીધ્ધાંતથી જરા પણ ચસ્યો નથી હું દેશમાં બે ત્રણ વખત ગયો હતો ત્યાંપણ આપણા જ્ઞાતિભાઇઓ કે જેઓએ શુધ્ધિ નથી કરાવી તેવા ભાઇઓનું રાંધેલું હું જમ્યો નથી એવું હું સોગનપુર્વક કહું છું. આનાથી વધારે ખાત્રી શું આપી શકું ?

ત્યારબાદ પ્રમુખ શ્રી **નારાયણજીભાઇએ** સભાને ઉદ્દેશીને જણાવ્યું કે આ બે ભાઇઓએ જે કહ્યું છે તેથી તમારી શંકા દુર થઇ હશે એમ મારૂં માનવું છે. કારણકે આવા નીર્મળ હ્રદય તેમજ ખરી ભાવનાથી પ્રતીજ્ઞાપુર્વક સત્ય કહેતા હોય તેમાં શંકાને સ્થાન નજ હોઇ શકે.

જે ભાઇઓને વહેમ હતો તે ભાઇઓ બોલી ઉઠયા કે બસ અમારી શંકાનું સમાધાન થઇ ગયું તેમજ અમને લેશ માત્ર પણ વહેમ રહેતો નથી.

realpatidar.com

https://archive.org/details/bk203/page/n15/mode/1up

realpatidar.com

તે પછી **પ્રમુખશ્રીએ** ખીમજી શીવજીના પક્ષકારો વિષે સભાને ઉદ્દેશી જણાવ્યું કે: કોઇ પણ વ્યકિતએ અમુક ગુન્હો કર્યો હોય અને તે ગુન્હો ખુલા શબ્દોમાં ખરા હૃદયથી કબુલ કરતો હોય તેમજ પોતાના કૃત્યને માટે જેને પારાવાર પસ્તાવો થતો હોય, અને તે આવી પવિત્ર સભામાં જે ગુન્હા કર્યા હોય **તેને માટે** દીલગીરી જાહેર કરે તો તેને નાતે શું કરવું જોઇએ ! મારી મત પ્રમાણે તો તેવા ભાઇની સજા તો તેનો પશ્ચાતાપજ છે. અને તે સર્વ ભાઇઓ એકી મતે કબુલ કરે એમ હું ઇચ્છું છું.

સભામાંથી સર્વ ભાઇઓ બોલી ઉઠયા કે ગુન્હેગાર ભાઇઓ પોતાના કૃત્યને માટે ખરા અંતઃકરણથી દીલગીરી જાહેર કરી માફી માગે તો તે ભાઇઓને માટે વધારે સજા ન કરતાં માફી આપવી જોઇએ.

ત્યારબાદ ભાઇશ્રી **અબજી મનજી** સેંગાણી ગામ નખત્રાણાવાલાએ કહ્યું કે મ્હેં ખીમજી શીવજીનો પક્ષ કર્યો હતો અને તેથીજ મંડળનું સુધારાનું કામ આજ છ છ વરસ થયાં પડી ભાંગ્યું બલ્કે સુધારાના કામને ધક્કો પહોંચ્યો છે એ હું જાણું છું. તેમજ કબુલ કરૂં છું. તેના માટે હું દીલગીર છું, તેમજ એ મારી ગંભીર ભુલ કબુલ કરૂં છું અને મારી તેવી ભુલને માટે આપ સર્વે જ્ઞાતિ બંધુઓના પાસે માફી માગું છું.

તે સમયનો દેખાવ ખરેખર અલૌકીક હતો, કારણ કે તે શબ્દો પુરા થવાની સાથેજ એક બીજાના હૃદય શુધ્ધ પ્રેમમય બની ગયાં. આંખોમાંથી જેમ ઘણા દિવસોએ બંધુમીલન થાય તેમ આનંદની જયોત ઝળકી રહી.

ત્યારબાદ ભાઇશ્રી **દાના કરસન** પાંચાણી ગામ નખત્રાણાવાલાએ પણ પોતે ખીમજી શીવજીનો પક્ષકાર હતો એમ કબુલ કરી પોતાની એ ભુલને માટે જ્ઞાતિભાઇઓ મને જે સજા કરે તે મારે કબુલ છે અને આપણા મંડળમાં ખીમજી શીવજીનો ફેંસલો ન થાય ત્યાં-સુધી તેમની સાથે બહિષ્કાર જેવું વર્તન રાખીશ. તેમજ મારા એ કૃત્યને માટે આપ સર્વ જ્ઞાતિભાઇઓ સમક્ષ માફી માગુંછું. એ પ્રમાણે કહ્યું.

તે પછી પ્રમુખશ્રી નારાયણજીભાઇએ સભામાં સર્વ ભાઇઓને ઉદ્દેશીને કહ્યું કે ભાઇશ્રી **અબજી મનજી તેમજ દાના કરસન** એ બે ભાઇઓએ સભા સમક્ષ પોતાની ભુલ કબુલ કરી માફી માગેછે, અને તે પણ શુધ્ધ હૃદય તેમજ આપણી જ્ઞાતિમાં સુધારો કરવાની ખરી ભાવનાથી. તેમ છતાં તેઓના બોલવા ઉપરથી એમ પણ સમજાય છે કે મંડળના ભાઇઓ અમારી ભુલના સંબંધમાં યોગ્ય લાગે તેમ કરે. પણ મંડળનું સુધારાનું મુખ્ય કામ કે જે **પીરાણા-સતપંથ રૂપી કાળું કલંક** આપણી જ્ઞાતિ ઉપરે છે તેને સત્વર નાબુદ કરવા પ્રથમના જેવુંજ ઉત્સાહભેર સુધારાનું કામ ચાલુ થવું જોઇએ. તો તે વિષે મારે એમજ કહેવું જોઇએ કે તે ભાઇઓએ પોતાની ભુલ બદલ મંડળને જેમ યોગ્ય જણાય તેમ કરે એમ કહ્યું. તેમજ તેઓએ ભુલ કબુલ કરતી વખતની તેઓની મુખાકૃતી ઉપરથી પણ એમ સમજાય છે કે તેઓને પોતે કરેલી ભુલથી અપાર દુઃખ ઉપજે છે તેમજ અનહદ પસ્તાવો પણ થાય છે. માટે તેમનો એ પસ્તાવો તેઓનું **પ્રાયશ્ચિત** છે અને એ **પ્રાયશ્ચિતજ** તેમની સજા છે, તેથી તેઓને તેમના સર્વે ગુન્હાની આ મંડળ માફી આપે છે અને ભવિષ્યમાં આવી ગંભીર ભુલ ન થાય તે તરફ ખાસ લક્ષ રાખે.

realpatidar.com

https://archive.org/details/bk203/page/n16/mode/1up

realpatidar.com

પછી પ્રમુખશ્રીએ સભામાં બેઠેલા સર્વે ભાઇઓને ઉદ્દેશીને કહ્યું કે આ બે ભાઇઓને તેમના ગુન્હાની માફી આપી છે તે બધાને કબુલ છે ? સર્વે ભાઇઓએ કહ્યું કે કબુલ છે કબુલ છે

ત્યારબાદ ખીમજી શીવજીએ મંડળના કાર્યકર્તા પાંચ ભાઇઓ ઉપરે ફોજદારી મુકર્દમો માંડયો હતો જે આપ સર્વ ભાઇઓ જાણો છો. તેનો બચાવ કરવા માટે જે ખર્ચ થયું છે તે ખીમજી શીવજીના પક્ષકારો સીવાયના મંડળના ભાઇઓની સંમતીથી થયું છે ? એમ શ્રીયુત પ્રમુખશ્રીએ સભામાં પ્રશ્ન કર્યો. તેના જવાબમાં ભાઇ **રામજી ધનજી નાકરાણી** કોટડાવાળાએ કહ્યું કે મુકર્દમામાં બચાવને માટે ખર્ચ કરવાનું મંડળના લગભગ દરેક મેમ્બરોએ કહ્યું હતું કે અત્યારે જે ખરચ થાય તે તમે પાંચ જણા કરો. પછી મંડળ તમોએ જે ખર્ચ કર્યું હશે તે આપશે.

પછી પ્રમુખશ્રીએ સભાને ઉદ્દેશીને પુછ્યું કે ભાઇ **રામજી** કહે છે તે વાત બરાબર છે ? એટલે સર્વે ભાઇઓએ કહ્યું કે એ વાત બરાબર છે.

ત્યારે એમ ઠર્યું કે જે ખરચ થયું હોય તે મંડળના પૈસામાંથી મજકુર પાંચ જણાને આપવું. અને પછી ખર્ચના હીસાબનો આંકડો માગવામાં આવતાં તેઓએ જણાવ્યું કે અત્યારે અમારી પાસે નથી ત્યારે તે ખરચની વાત મંડળનો હીસાબ થાય તે વખતે હાથ લેવાનું ઠર્યું ત્યારબાદ પ્રમુખશ્રી **નારાયણજીભાઇએ** કેટલાંક બોધદાયક વચનો કહી સભા વિસર્જન કરી હતી.

ભાઇશ્રી રતનસી વીરજીએ પોતાની ભુલ કબુલ કરી નહિ તેમજ માફી માગી નહિ જેથી મંડળના સમુહથી જુદા રહી ગયા.

૨૧-૫-૧૯૩૨ ના દિવસની કાર્યવાહી.

તા. ૧૭થી તા. ૨૦-૫-૧૯૩૨ સુધી એમ ચાર દિવસ ભાઇશ્રી **જીવરાજ વાલજીના** લગ્ન પ્રસંગે રોકાણ થવાથી આજરોજે ભાઇશ્રી **નારાયણજી રામજીના** ઉતારે મંડળના ઘણા ખરા ભાઇઓ ભેગા થયા હતા. અને મંડળના નાણાંનો હિસાબ જે ભાઇશ્રી **રતનસીંહ શીવજી** પાસે નાણાં વ્યાજે હતા તે તથા લવાજમ સબંધમાં આયાત ખરચ થયું હતું તે સર્વ હિસાબ તપાસ્યો હતો. તે મુજબ હિસાબ ચોકખા કર્યા બાદ **નારાયણજીભાઇએ** મંડળના ભાઇઓમાં કેટલીક ગેરસમજુતી ફેલાયલી તે બાબતોની યોગ્ય સમજાવટ કરી તેમજ સુધારાને અંગે કેટલાંક બોધદાયક વચનો કહ્યાં. બાદ સર્વ ભાઇઓ મોડી રાતે નિવૃતી માટે પોતપોતાને ઘેર ગયા.

તા. ૨૨-૫-૧૯૩૨ ના દિવસની કાર્યવાહી.

તા. ૨૨-૫-૧૯૩૨ના રોજ **નારાયણજીભાઇને** ઉતારે મંડળના સર્વે ભાઇઓ રાત્રે દશ વાગે ભેગા મળી યુવક મંડળના કાર્યકર્તાઓની ફરીથી ચુંટણી કરવા તેમજ **શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળના** ખાસ નીયમો બધારણ અને ધારા ધોરણો નક્કી કરવા તથા ખાસ કરીને આગળના વખતે જે વયોવૃધ્ધને જુદા રાખવામાં આવ્યા હતા તેને યુવકોની સાથે મળીને કામ કરવા માટે સાથે લેવા, તથા નવેસરથી મંડળના બંધારણો બાંધવા તેમજ અનેક પ્રકારના નીયમો ધોરણસર રચવા માટે ભેગા થયા હતા.

realpatidar.com

https://archive.org/details/bk203/page/n17/mode/1up

realpatidar.com

આગલા દિવસોએ કેટલાક ભાઇઓ હાજર નહિ હોવાથી આગળ થયેલ હિસાબ બધા ભાઇઓની જાણ માટે ફરીથી વાંચી સંભળાવવામાં આવ્યો હતો. તેમજ આગળની વખતે કેટલાક ભાઇઓની સમજથી જ્ઞાતિ મંડળના જુદા જુદા ફાટાઓ જેવા કે જ્ઞાતિપંચ, લાયબ્રેરીખાતું તેમજ જ્યોતીધામ—મંદિર વિગેરે વિગેરે કરવામાં આવ્યાં હતાં. તેમજ મોટેરાઓને જુદા રાખવામાં આવ્યા હતા, જેથી ખરૂં જોતાં જ્ઞાતિની સેવાનું કામ બરાબર થઇ શકતું નહોતું. એવું બધા ભાઇઓને જણાવાથી તે સર્વ ખાતા સાથે જોડી દઇ એકજ "શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળ" ના નામથી કામ કરવાનું યોગ્ય જણાતાં તે નામ કાયમ રાખી અને ખાસ યુવક મંડળની નવેસર ચુંટણીનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.

તે વખતે **નારાયણજીભાઇએ** સર્વ ભાઇઓને ઉદેશી કહ્યું કે જે ભાઇઓને મંડળના મેમ્બરો થવાની ઇચ્છા હોય તેઓએ અત્યારેજ નામ લખાવવા કારણ કે જેટલા મેમ્બરોના નામ લખાશે ત મેમ્બરોમાંથી **પ્રમુખ, સેક્રેટરી ખજાનચી** વિગેરે મુખ્ય કાર્યકર્તાઓ તેમજ વ્યવસ્થાપક મંડળના મેમ્બરો પણ તેમાંથી ચુંટી કાઢવામાં આવશે. જે બહુ મતે નક્કી કરવામાં આવશે.

ત્યારબાદ નીચેના ભાઇઓએ મંડળના મેમ્બર તરીકે નામ લખાવ્યાં હતાં.

(૧) અબજીભાઇ મનજી સેંગાણી ગામ નખત્રાણાવાળા
(૨) વીશ્રામભાઈ પાંચા ગાંગાણી ગામ વિરાણીવાળા
(૩) રતનસીભાઇ શીવજી નાકરાણી ગામ રવાપુરવાળા
(૪) શીવજીભાઈ કાનજી પારસીઆ ગામ નખત્રાણાવાળા
(૫) જેઠાભાઈ નથુ નાકરાણી ગામ દેવીસરવાળા
(૬) લાલજીભાઇ સોમજી નાકરાણી ગામ રવાપુરવાળા
(૭) નારાયણભાઇ શીવજી લીંબાણી ગામ વીરાણીવાળા
(૮) જીવરાજભાઇ હીરજી ઉકાણી ગામ માનકુવાવાળા
(૯) નારાયણભાઇ નથુ છાભઇઆ ગામ દેવીસરવાળા
(૧૦) દાનાભાઈ કરસન પાંચાણી ગામ નખત્રાણાવાળા
(૧૧) સામજીભાઇ વીરજી રૂડાણી ગામ દેશલપુર (ઉગમણા)
(૧૨) રામજીભાઇ સોમજી નાકરાણી ગામ રવાપુરવાળા
(૧૩) હરજીભાઈ નથુ છાભઇઆ ગામ દેવીસરવાળા
(૧૪) શીવજીભાઈ લધા નાકરાણી ગામ નખત્રાણાવાળા
(૧૫) પ્રેમજીભાઇ હરજી સાંખલા ગામ દેશલપુર (આથમણા)
(૧૬) મેઘજીભાઇ કાનજી સેંગાણી ગામ મમાઇમોરાવાળા
(૧૭) નથુભાઇ નારાયણ પાંચાણી ગામ નખત્રાણાવાળા
(૧૮) માવજીભાઇ મેઘજી નાકરાણી ગામ વીરાણી (કોરાવાળી)
(૧૯) લાલજીભાઈ ભાણજી ભાથાણી ગામ વીરાણીવાલા
(૨૦) દેવજીભાઇ નાનજી પાંચાણી ગામ નખત્રાણાવાળા
(૨૧) નથુભાઈ વીરજી રૂડાણી ગામ દેશલપુર (ઉગમણા)

realpatidar.com

https://archive.org/details/bk203/page/n18/mode/1up

realpatidar.com

(૨૨) વેલજીભાઈ રૂડા દાનાણી ગામ નખત્રાણાવાળા
(૨૩) હંસરાજભાઇ રામજી વેલાણી ગામ દેશલપુર (આથમણી)
(૨૪) લધાભાઈ કરસન નાકરાણી ગામ વીરાણીવાળા
(૨૫) મુળજીભાઇ પુંજા ભગત ગામ નખત્રાણાવાળા
(૨૬) લધાભાઇ હરજી નાકરાણી ગામ કોટડા જડોદરવાળા
(૨૭) વેલજીભાઇ ગોપાલ સાંખલા ગામ દેશલપુર (આથમણી)
(૨૮) માવજીભાઇ પરબત ધોળુ ગામ વીરાણીવાળા
(૨૯) વેલજીભાઇ પરબત પારસીઆ ગામ નખત્રાણાવાળા
(૩૦) મુળજીભાઇ ડોસા પોકાર ગામ નખત્રાણાવાળા
(૩૧) વાલજીભાઇ લખુ પોકાર ગામ નખત્રાણાવાળા
(૩૨) વીરજીભાઇ લખુ પોકાર ગામ નખત્રાણાવાળા
(૩૩) ખેતાભાઇ ગોપાલ કેસરાણી ગામ નખત્રાણાવાળા
(૩૪) રતનસીભાઇ ગોપાલ કેસરાણી ગામ નખત્રાણાવાળા
(૩૫) રામજીભાઈ કાનજી ધોળુ ગામ વીરાણીવાળા
(૩૬) નાગજીભાઇ ખીમજી લીંબાણી ગામ આણંદસરવાળા
(૩૭) કરમસીભાઇ દેવસી છાભઇઆ ગામ દેવીસરવાળા
(૩૮) ગોપાલભાઇ કરસન ચોધરી ગામ નખત્રાણાવાળા
(૩૯) રતનસીભાઇ કરસન ચોધરી ગામ નખત્રાણાવળા
(૪૦) પચાણભાઇ પરબત છાભઇઆ ગામ કોટડા જડોદરવાળા
(૪૧) કરસનભાઇ પરબત પારસીઆ ગામ નખત્રાણાવાળા
(૪૨) વીસરામભાઈ જીવરાજ પોકાર ગામ મંગવાણાવાળા.
(૪૩) ધનજીભાઈ હરજી ગોગારી ગામ અઇઅરવાળા
(૪૪) વીરજીભાઇ રતનસી નાકરાણી ગામ માલકાવાળા
(૪૫) ભાણજીભાઇ શીવજી નાથાણી ગામ નખત્રાણાવાળા
(૪૬) મનજીભાઇ જેઠા કાનજીઆણી ગામ વીરાણીવાળા

ઉપર જણાવ્યા મુજબ છેંતાલીશ મેમ્બરોમાંથી યુવક મંડળના પ્રમુખ તરીકે ભાઇશ્રી અબજી મનજી સેંગાણી નખત્રાણાવાળાને વધુમતે ચુંટવામાં આવ્યા છે, અને ઉપ-પ્રમુખ તરીકે ભાઇશ્રી વીશ્રામ પાંચા ગાંગાણી ગામ વીરાણીવાળાને પસંદ કરવામાં આવ્યા છે. યુવક મંડળના સેક્રેટરી તરીકે ભાઇશ્રી **રતનસી શીવજી નાકરાણી** ગામ રવાપુરવાળાને પસંદ કરવામાં આવ્યા છે અને જોઈન્ટ સેક્રેટરી તરીકે ભાઇશ્રી **શીવજી કાનજી** પારસીઆ ગામ નખત્રાણાવાલા ને નીમવામાં આવ્યા છે અને ખજાનચી તરીકે શ્રીમંત ભાઇશ્રી **જેઠાભાઈ નથુ નાકરાણી** ગામ દેવીસરવાળાની વધુમતે પસંદગી કરવામાં આવી છે.

તે ઉપરાંત યુવક મંડળના છેતાલીસ મેમ્બરોમાંથી વ્યવસ્થાપક મંડળના કાર્યકર્તાઓ તરીકે નીચે જણાવેલા અગીયાર ભાઇઓની સર્વાનુમતે ચુંટણી કરવામાં આવી હતી.

(૧) ભાઇશ્રી અબજીભાઇ મનજી સેંગાણી ગામ નખત્રાણાવાળા (યુવક મંડળના પ્રમુખ)
(૨) ,, વીશ્રામભાઇ પાંચા ગાંગાણી ગામ વીરાણીવાળા (,, ઉપપ્રમુખ)

realpatidar.com

https://archive.org/details/bk203/page/n19/mode/1up

realpatidar.com

(૩) ભાઇશ્રી રતનસીભાઇ શીવજી નાકરાણી ગામ રવાપુરવાળા (યુવક મંડળના સેક્રેટરી)
(૪) ,, શીવજીભાઈ કાનજી પારસીઆ ગામ નખત્રાણાવાળા (,, જોઇન્ટ સેક્રેટરી)
(૫) ,, જેઠાભાઇ નથુ નાકરાણી ગામ દેવીસરવાળા (,, ખજાનચી)
(૬) ,, લાલજીભાઇ સોમજી નાકરાણી ગામ રવાપુરવાળા
(૭) ,, નારાયણભાઇ શીવજી લીંબાણી ગામ વીરાણીવાળા
(૮) ,, જીવરાજભાઇ હીરજી ઉકાણી ગામ માનકુવાવાળા
(૯) ,, નારાયણભાઇ નથુ છાભઇઆ ગામ દેવીસરવાળા
(૧૦) ,, દાનાભાઇ કરસન પાંચાણી ગામ નખત્રાણાવાળા
(૧૧) ,, સામજીભાઇ વીરજી રૂડાણી ગામ દેશલપુર (ઉગમણા)

ત્યારબાદ શ્રી **કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળના** ધારા ધોરણ અને નીયમો **શ્રી કચ્છ કડવા પાટીદાર પરીષદ** ત્રીજીમાં ઠરાવ રૂપે પસાર કરવામાં આવેલ હતા તેમાંથી ઇ. સ. ૧૯૨૬માં કેટલાક ફેરફારો સાથે યુવક મંડળે તૈયાર કર્યા હતા તેજ ધારા ધોરણ અને નીયમો આ વખતે બહાલ રાખવામાં આવ્યા હતા જે નીચે મુજબ છે

શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળના ઉદેસ અને નીયમો.

આપણી કડવા પાટીદાર જ્ઞાતિ કચ્છ. કાઠીઆવાડ, ગુજરાત, નીમાડ, માળવા વિગેરે આ દેશના જુદા જુદા ભાગોમાં વસે છે, અને તે દરેક વિભાગમાં જ્ઞાતી સ્થિતી સુધારવા સંસ્થાઓ કે મંડળો સ્થાપી લાંબા સમયથી પ્રયત્ન કરવામાં આવે છે. આવાં દરેક મંડળો સમસ્ત જ્ઞાતિની "**શ્રી કડવા પાટીદાર પરીષદ**" નામે જે મોટી સંસ્થા છે તેના આશ્રય નીચે રહી પોતપોતાની જરૂરીઆતની મુખ્ય સંસ્થાને જાણ કરે છે, અને પરીણામે જ્ઞાતિ હીત સાધવાનો માર્ગ સરળ થાય છે. આ મુખ્ય સંસ્થાની સ્થાપના થયા પછી દેશકાલને લઈ જ્ઞાતિમાં ઘર કરી બેઠેલા અધર્મયુક્ત રીતરિવાજોનો ત્યાગ થતો આવે છે. અને ઘણા કાળથી એક બીજાથી જુદાપડી ગયેલા પોતાનાજ બંધુઓ સાથે ઐક્ય સાધવાનું મહત્વનું કાર્ય સિધ્ધ થતું જાય છે. આ શુભ કાર્યમાં આપણા કચ્છ વિભાગે પણ કેટલેક અંશે ભાગ લીધો છે. પરંતુ સમસ્ત જ્ઞાતિથી આપણા વિભાગને અલગ પાડી દેનાર અધર્મયુક્ત પીરાણા–સતપંથનો ત્યાગ કરવાનું જે મહાન કાર્ય આપણા વિભાગે કરવાનું છે. તે ઉદ્દેશ અને કાર્ય ધ્યાનમાં લઇ **શ્રી કચ્છ કડવા પાટીદાર પરિષદ** નામે જે સંસ્થા સ્થાપવામાં આવી છે તેને અનુસરીને તેના પેટા વિભાગ તરીકેજ આ જ્ઞાતી સુધારક યુવક મંડળની સ્થાપના કરવામાં આવી છે. તેના ઉદ્દેશ અને નીયમો નીચે પ્રમાણે છે.

ઉદ્દેશ :—

[૧. આપણી સમસ્ત જ્ઞાતિથી આપણને અલગ પાડી દેનાર તેમજ હીંદુપણામાંથી આપણને ટાળી દેનાર પીરાણુ સતપંથને જ્ઞાતિમાંથી નાબુદ કરવો, અને કોઇ પણ જોખમે અને ખરચે એ કાર્ય પ્રથમ હાથ ધરવું એ આ મંડળનો મુખ્ય ઉદ્દેશ છે]

૨ બાળલગ્નના અધર્મયુક્ત અને હાનીકારક રીવાજને જ્ઞાતિમાંથી સત્વરે નાબુદ કરવો તે આ મંડળનો મુખ્ય ઉદ્દેશ છે. તેને ખાસ ધ્યાનમાં લઇ જ્ઞાતિ સુધારક યુવક મંડળના મેમ્બરોમાંના કોઇએ પણ બાળલગ્ન ન કરવા અને જ્ઞાતિમાંનો કોઇપણ ભાઇ પોતાના બાળકોને

realpatidar.com

https://archive.org/details/bk203/page/n20/mode/1up

realpatidar.com

એવી રીતે બાળલગ્નથી પરણાવતો હોય તો તેને સમજાવી તેમ ન કરવાની સમજુતી આપવી એ આ મંડળના દરેક મેમ્બરની મુખ્ય ફરજ રહેશે.

૩ મરણુ પાછળના કારજો કરવાનો રિવાજ શાસ્ત્ર વિરૂધ્ધ અયુક્ત, ખરચાળ અને દુર્દશાએ પહોંચાડનારો હોવાથી તેને સદંતર નાબુદ કરવા, અને તેવાં જમણો નહિ જમવાનો આપણી જ્ઞાતિની પન્થિદે ઠરાવ કરેલ છે, તેને અનુસરીને આ મંડળના કોઇ પણ મેમ્બરે તેવા ખર્ચો નાહે કરવા, તેમજ તેમાં ભાગ પણ નહિ લેવો એ તેમની મુખ્ય ફરજ છે.

૪ વિદ્યાએ સર્વોતમ શકિત હોવાથી તેનો બહોળો પ્રચાર જ્ઞાતિના તેમજ પોતાના પુત્ર પુત્રીઓને પુરતી કેળવણી આપીને કરવાનો ખાસ ઉદ્દેશ ધ્યાનમાં રાખવો, એમાં આ મંડળના મેમ્બરો પોતાની મુખ્ય ફરજ સમજશે.

૫ જ્ઞાતિની આર્થીક સ્થિતી સુધારવી અને ઐકયતા વધારવી એ ખાસ જરૂરનું છે જેથી દરેક ભાઇએ પોતાના જ્ઞાતિ બંધુઓને બનતી દરેક પ્રકારની મદદ કરવી, તેમજ કામ-ધંધામાં આગળ વધારવા તથા ખેતીવાડી વિગેરે બીજા ઉદ્યોગોની કેળવણી મેળવી એક બીજાને સહાયભૂત થવું એ આ મંડળનો ખાસ ઉદ્દેશ છે

૬ ઉપદેશકો રોકીને, સભાઓ અથવા મીટીંગો ભરીને. ચોપાનીયાં કે પુસ્તકો પ્રસિદ્ધ કરીને જ્ઞાતિમા જ્ઞાનનો ફેલાવો કરવો તથા આ મંડળના ઉદ્દેશો બર લાવવા માટે જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે જ્ઞાતિબંધુઓની મદદ લઇને પગારદાર અથવા બીજા પગાર-દાર માણસો રોકી યોગ્ય ખર્ચો કરીને આ મંડળનો મુખ્ય ઉદ્દેશ બર લાવવામાં આવશે.

૭ આ મંડળનું દરેક પ્રકારનું કામકાજ કચ્છ દેશના રહીશ હોય એવા કડવા પાટીદાર બંધુઓના હીતાર્થે જ થશે. પરંતુ એવો પણ ઉદ્દેશ છે કે આ મંડળની સ્થિતી સુ-ધરતી હોય તો જ્ઞાતિ વિસ્તારના બીજો ભાગો તરફ પણ ધ્યાન આપવામાં આવશે. વળી કોઇપણ પ્રયત્ને સમસ્ત જ્ઞાતિમાં આપણા કચ્છ વિભાગનું પ્રતિનીધીત્વ સાચવી રાખવા આ મંડળ બનતા દરેક પ્રયત્નો ચાલુ રાખશે.

નીયમો:—

૧ કોઇપણ વિભાગના કડવા પાટીદાર બંધુઓ આ મંડળના મેમ્બર થઇ શકશે, અને મંડળ તરફથી નકકી કરવામાં આવેલી ચાર આના ફી આપવાથી અને મંડળના ઉદ્દેશ અને નીયમોનો અંગીકાર કર્યેથી મેમ્બર તરીકેના દરેક હકક તેને પ્રાપ્ત થશે.

૨ આ મંડળની સિંધ પ્રદેશ ખાતેના મુખ્ય ઓફીસ કરાચીમાં રહેશે અને જરૂર જણાતાં બીજી જગ્યાએ પેટા ઓફીસો ખોલવામાં આવશે.

૩ આ મંડળનો ઉદ્દેશ બર લાવવા માટે બહુમતે ઉપયોગ થશે, અને જે જે ભાઇઓ જે જે કાર્ય માટે યોગ્ય જણાશે તેમની કમીટીદ્વારા અથવા વ્યકિતત્વ પરત્વે નીમ-ણુંક કરવામાં આવશે. તેમજ આ મંડળનો ઉદ્દેશ બર લાવવા અને તેનો વહીવટ કરવા સારૂ અગીઆર વ્યવસ્થાપકોની કમીટી નીમવામાં આવી છે તેને આ મંડળના ઉદ્દેશના અંગે ઉત્પન્ન થતું દરેક કાર્ય કરવાની સત્તા રહેશે. અને તે માટે યોગ્ય ખરચ પણ કરી શકશે

realpatidar.com

https://archive.org/details/bk203/page/n21/mode/1up

realpatidar.com

આ મંડળની ખાસ મીટીંગ દર પંદર દિવસે ભરવામાં આવશે અને દર મહીનાની છેલ્લી તારીખે મહીના દિવસમાં થયેલું કામકાજ અને મંડળના અંગે થયેલા ખરચનો હિસાબ સેક્રેટરીએ મંડળના મેમ્બરોને સંભળાવવો. અને તે સિવાય વ્યવસ્થાપક મંડળના સભ્યોને કાંઇ ખાસ કારણસર મીટીંગ બોલાવવાની જરૂર પડે તો તે બોલાવી શકશે. આવા પ્રકારની મીટીંગ બોલાવવાની ખબર કમીટીના મેમ્બરોને મંડળના સેક્રેટરીએ અગાઉથી આપવી.

૫ વ્યવસ્થાપક મંડળ પોતાની મિટીંગ જ્યારે જ્યારે જરૂર જણાશે ત્યારે બોલાવી શકશે, અને ઓછામાં ઓછા ૧/૩ જેટલા મેમ્બરો હાજર હશે તે વખતે મંડળના ઉદ્દેશને બાધ ન આવે તેવા જરૂર પડતા કામકાજો કરવાની વ્યવસ્થાપક મંડળને સત્તા રહેશે.

૬ મંડળનો ઉદ્દેશ બર લાવવા માટે અને મંડળના નિભાવ અર્થે તેમજ મંડળની મીટીંગોમાં થયેલ કામકાજના હેવાલો છપાવવા અર્થે જે કાંઇ પઇસાની જરૂર પડે ત માટે કાંઇ ખાસ ફંડ કરવામાં નહિ આવ્યું હોય તો મંડળના મેમ્બરોની માસીક ફીના ચાર આનાવાળા ફંડમાંથી ખર્ચ કરવામાં આવશે.

૭ આ મંડળની દરેક મીટીંગમાં થતા કામકાજની એક નોંધ વ્યવસ્થાપક કમીટી તરફથી રાખવામાં આવશે તે પ્રોસીડીંગ બુક ગણાશે, દરેક મીટીંગ પછી તે મોટી હોય કે વ્યવસ્થાપકોની હોય તેના કાર્યનો હેવાલ લખાઇ ગયા બાદ તે કાર્ય જેના પ્રમુખપણા નીચે થયું હોય તે તેના નીચે પોતાની સહી કરશે.

૮ મંડળનો કોઇપણ મેમ્બર મંડળના ઉદ્દેશ કે હેતુ અને નિયમોથી વિરૂધ્ધ જવાપણું કરી શકશે નહિ. અને તે વિરૂધ્ધ વર્તન કરનારનો મેમ્બર તરીકેનો હક્ક છીનવી લેવામાં આવશે.

૯ આ મંડળે પસાર કરેલા મંડળના નિયમો અને ઉદ્દેશોનો અમલ કરાવવો અને કરવો એ દરેક ભાઇની ફરજ ગણાશે. અને એ કાર્ય માટે જેની નીમણુંક કરવામાં આવી હોય તે બન્ધુ તેના કાર્ય માટે આ મંડળને જવાબદાર રહેશે. પરંતુ જેની પધ્ધતીસર નીમણુંક નહિ થઇ હોય તેવા કોઇપણ મેમ્બરના કોઇ પ્રકારના કાર્ય માટે આ મંડળ જવાબદાર રહેશે નહિ.

૧૦ આ મંડળનું કાર્ય એ જ્ઞાતિ હિતનું કાર્ય છે એમ સમજી જે જે વિભાગના ભાઇઓ આ મંડળને જે જે પ્રકારે મદદ કરશે તે ઉપકાર સાથે સ્વીકારવામાં આવશે પરંતુ પરજ્ઞાતિના કોઈપણ ગૃહસ્થ તરફની આર્થીક મદદ સ્વીકારવી કે નહિ તેનો વ્યવસ્થાપકો સમયને અનુસરીને નિર્ણય કરશે.

સુચના :—

દરેક ભાઇઓ આ મંડળના નિયમો અને ઉદ્દેશને બરાબર જાણી અને સમજીને મેમ્બર થયા છે એટલે આ મંડળનો જ્ઞાતિ હીત સાધવાનો ઉદ્દેશ તેમની મદદવડે જલદીથી બર આવશે. એથી આ મંડળને ખાત્રી રહે છે. અને હવે પછી નવા થનારા મેમ્બરોએ આ મંડળના ઉદ્દેશ અને નિયમોને વાંચી વિચારી અને પોતાને યોગ્ય લાગેતો બાજુના પાનાપરનું અંગીકરણપત્ર ભરી સેક્રેટરી તરફ મોકલી આપવું અને જ્ઞાતિહીતના કાર્યમાં જોડાવું. એવી દરેક જ્ઞાતિ બંધુઓને વિનંતી કરવામાં આવે છે

લી. રતનસીભાઈ શીવજી સેક્રેટરી.

હેડ ઓફીસ શ્રીચંદ, વિશનદાસ રોડ, ગાર્ડન ક્વાર્ટર કરાચી

realpatidar.com

https://archive.org/details/bk203/page/n22/mode/1up

realpatidar.com

અંગીકરણ પત્ર

શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળના સેક્રેટરી જોગ, હેડ ઓફીસ : ગાર્ડન ક્વાર્ટર. શ્રીચંદ વિશનદાસ રોડ કરાચી.

હું નીચે સહી કરનાર……તુખે……ઉમર વર્ષ……ગામ……ઠેકાણું…… આ ઉપરથી વિનંતી કરૂં છું કે જ્ઞાતિ સુધારક યુવક મંડળના ઉદ્દેશ અને નિયમો મેં જાતે સમજીને જાણ્યા છે અને જ્ઞાતિ હીતના માટે તે ખાસ જરૂરના છે એવી મારી ખાત્રી થઇ છે. એટલે તે પાળવા અને પળાવવા હું મારાથી બનતું કરવાનો વિશ્વાસ આપી આ મંડળનો મેમ્બર થવાની માંગણી કરૂં છું તે સ્વીકારવામાં આવશે એવી આશા છે, સહી……દા. પોતે

ઉપર પ્રમાણેના **જ્ઞાતિ સુધારક યુવક મંડળના** ઉદ્દેશ અને નિયમોનું બંધારણ નક્કી કર્યા બાદ, બીજી પણ કેટલીક અગત્યની વાટાઘાટો કરી, દરેક ભાઇઓએ એક બીજાના મનનું સમાધાન કર્યું હતું.

યુવક મંડળના ભાઇઓએ પણ સ્વતંત્ર રીતે જ્ઞાતિ સુધારકનું કામ કરી દેખાડવા માટે ભાઇશ્રી **નારાયણજીભાઇને** ઉત્સાહ પુર્વક વચન આપ્યું હતું તથા તેમને દરેક પ્રકારે મદદ કરતા થઇ પડશે એમ જણાવ્યું હતું.

તે પછી ભાઇશ્રી **નારાયણજીભાઇએ** ઉભા થઇને પોતાના સગા સબંધીઓ તેમજ જ્ઞાતિ બંધુઓને કહ્યું કે મારે ઉતાવળે કચ્છ જવાનું હોવાથી હવે વધારે વખત રોકાઇ શકું તેમ નથી. હું કાલે સવારના ૯–૨૦ના ટાઇમે રેલ્વે રસ્તેથી કચ્છ તરફ રવાનો થાઇશ, તેથી દરેક ભાઇને વિનંતી કરીને કહું છું કે જેવી રીતે આપ ભાઇઓએ એક બીજાની ભુલો કબુલીને સંપ કર્યો છે અને કાયદા કાનુનો ઘડયા છે તે મુજબ હરહંમેશાં સંપ સલાહથી કાયદા મુજબ સર્વ ભાઇઓ વર્તશો કે જેથી આપણી જ્ઞાતિનું સુધારાનુ કામ આગળ વધારી શકીયે.

તા. ૨૩ના સવારના ૯–૨૦ના ટાઇમે ક્વેટા મેલ દ્વારા **નારાયણજીભાઈ** જવાના હોવાથી સીટી સ્ટેશને ઘણા ખરા સુધારક ભાઈઓ પોતાના કામ ધંધા છોડીને વિદાયગીરી આપવા ગયા હતા. તેમાંથી કેટલાક ભાઇઓતો સદર સ્ટેશન સુધી ગયા હતા. બાદ વિદાય-ગીરીના શીષ્ટાચાર કરી ભારે હૃદયે ગાડી ઉપડતાં કુળ દેવીની જય ગર્જના કરી છુટા પડયા હતા.

જ્યારથી સુધારાની હીલચાલ શરૂ થઇ છે ત્યારથી આગેવાનો તરફથી સુધારાવાળાને સતાવવાનો પ્રયાસ ચાલુજ હતો. જેથી સ્વમાનની કીમત સમજવાવાળા ભાઇઓએ અર્ધદગ્ધ પાખંડી પંથમાં ન હીંદુ તેમજ ન મુસલમાન જેવી સ્થિતીમાં રહેવા કરતાં શુધ્ધિ કરાવી પીરાણા–સતપંથ તેમજ જુલ્મગાર આગેવાનોના પંજામાંથી મુક્ત થવું એજ શ્રેયસ્કર છે, એવું સમજી ને કચ્છમાં ઘણા ભાઇઓ દેહ શુધ્ધિ પ્રાયશ્ચિત લેવા મંડયા છે. તે મુજબ ગામ દયાપુર, પાનેલી, રવાપુર મથલ વિગેરે ગામના ભાઈઓએ દેહ શુધ્ધિ પ્રાયશ્ચિત લીધેલ જેથી જુલ્મગાર આગેવાનોના પંજામાંથી મુક્ત થયા છે અને મુમના નામ ધારી પીરાણા પંથી કહેવાય છે તેઓના સાથે ખાવા પીવાનું પણ બંધ કરી દીધું અને પોતે પીરની કબરો પુજતા

realpatidar.com

https://archive.org/details/bk203/page/n23/mode/1up

realpatidar.com

હતા તે મુકી હીંદુ સનાતન દેવોના ઉપાશક થયા, તે જોઇને ગામ વીરાણી કોરાવાલીના કેટલાક બંધુઓમાં જાગ્રતી આવી તેથી શ્રી સત્યનારાયણનું મંદિર કરી દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત સવંત ૧૯૮૮ (કચ્છ સવંત) ના શ્રાવણ શુદ ૧૨ ના દિવસ ગામશ્રી કોરાવારી વીરાણીમાં પીરાણા-પંથી પાટીદાર ભાઇઓએ પીરાણા પથને તીલાંજલી આપી શુધ્ધ સનાતન વેદીક ધર્મની દીક્ષા દયાપુરવાળા ત્રવાડી મણીશંકર અંબારામ કે જે પાટીદાર જ્ઞાતિના સુભેચ્છક છે તેને હસ્તે દેહશુધ્ધ પ્રાયશ્ચિત લઇ યજ્ઞોપવિત ધારણ કર્યા છે જેના નામ નીચે મુજબ છે.

Satyanarayan Temple Virani Koravali VSA: 24-Aug-1931

(૧) પટેલ રામજી કેશરા ભાવાણી

(૨) ચી. પટેલ પચાંણ } તે પટેલ રામજી કેશરાના પુત્રો
(૩) ચી, ,, કાનજી

(૪) સૌ. બેન પુરબાઈ તે પચાંણ રામજીના ધર્મપતિન

(૫) ચી. કરસન } તે પચાંણ રામજીના પુત્ર પુત્રીઓ
(૬) ચી. પરબત
(૭) ચી. બાઇ વાલબાઇ
(૮) ચી. બાઇ વેલબાઇ
(૯) ચી. બાઇ પાનબાઇ

(૧૦) સૌ. બેન જમનાબાઇ તે કરશન પચાંણના ધર્મપતિન
(૧૧) પટેલ કાનજી રામજી ભાવાણી
(૧૨) સૌ. બેન પાનબાઇ તે કાનજી રામજીના ધર્મપતિન

(૧૩) ચી. મનજીભાઇ } તે કાનજી રામજીના પુત્ર પુત્રીઓ
(૧૪) ચી. બાઈ કાનબાઇ
(૧૫) ચી. બાઇ માનબાઇ
(૧૬) ચી. બાઇ મરઘાંબાઇ

(૧૭) પટેલ લધા કેશરા મૈયાત

(૧૮) ચી. વાલજીભાઇ } તે લધા કેશરાના પુત્ર પુત્રીઓ
(૧૯) ચી. સોમજીભાઇ
(૨૦) ચી. બાઇ પાનબાઇ
(૨૧) ચી. બાઇ પદમાબાઇ

(૨૨) માતુશ્રી સેજબાઇ તે લધા કેશરાની માતુશ્રી
(૨૩) સૌ. બહેન નાનબાઈ તે વાલજી લધાના ધર્મપતિન

(૨૪) ચી. નાનજીભાઇ } તે વાલજી લધાના પુત્રો
(૨૫) ચી. કરસનભાઇ
(૨૬) ચી. નારાયણભાઇ

(૨૭) પટેલ સોમજી લધા
(૨૮) સૌ. બહેન નાનબાઈ તે સોમજી લધાના ધર્મપતિન

realpatidar.com

https://archive.org/details/bk203/page/n24/mode/1up

realpatidar.com

(૨૯) ચી. બાઈ ભાણબાઇ તે સોમજી લધાની પુત્રિ
(૩૦) પટેલ વાલજી નથુ પોકાર
(૩૧) સૌ. બહેન ગોમગીબાઈ તે વાલજી નથુના ધર્મપત્નિ
(૩૨) ચી. બહેન રાજબાઇ તે વાલજી નથુની પુત્રી
(૩૩) પટેલ લાલજી પુંજા ગોરાણી
(૩૪) સૌ. બહેન મેઘબાઇ તે લાલજી પુંજાના ધર્મપત્નિ
(૩૫) પટેલ વાલજી ભીમજી ભગત
(૩૬) સૌ. બહેન વાલબાઇ તે વાલજી ભીમજીના ધર્મપત્નિ
(૩૭) ચી. દેવજીભાઇ
(૩૮) ચી. બાઇ રતનબાઇ
} તે વાલજી ભીમજીના પુત્ર પુત્રીઓ
(૩૯) પટેલ નથુ નાઇઆ વાસાણી
(૪૦) ચી. મનજીભાઇ તે નથુ નાઇઆનો પુત્ર
(૪૧) બાઇ ધનબાઇ વિધવા
(૪૨) ચી. દેવશીભાઇ
(૪૩) ચી. બાઇ કાનબાઇ
(૪૪) ચી. બાઇ પદમાબાઇ
} તે ધનબાઇના પુત્ર પુત્રીઓ
(૪૫) પટેલ મનજી નથુ
(૪૬) સૌ. બહેન નાનબાઇ તે મનજી નથુના ધર્મપત્નિ
(૪૭) ચી. લાલજીભાઇ
(૪૮) ચી. બાઇ મરઘાંબાઇ
(૪૯) ચી. બાઇ મુળબાઇ
(૫૦) ચી. બાઇ જમનાબાઇ
(૫૧) ચી. બાઈ ગંગાબાઇ
} તે મનજી નથુના પુત્ર પુત્રીઓ
(૫૨) પટેલ હરજી શીવજી પોકાર
(૫૩) સૌ. બહેન સેજબાઇ તે હરજી શીવજીનાં ધર્મપત્નિ
(૫૪) ચી. દાઇઆભાઇ
(૫૫) ચી. ભાણજીભાઇ
} તે હરજી શીવજીના પુત્ર
(૫૬) પટેલ પચાંણ ખીમા પારસીઆ
(૫૭) સૌ. બહેન નાથીબાઇ તે પચાંણ ખીમાની ધર્મપત્નિ
(૫૮) ચી હરજીભાઇ
(૫૯) ચી. બાઇ રાજબાઇ
(૬૦) ચી. બાઇ મરઘાંબાઈ
(૬૧) ચી. બાઇ રતનબાઇ
(૬૨) ચી. બાઇ માનબાઈ
(૬૩) ચી. બાઇ લખમાબાઇ
} તે પચાંણ ખીમાના પુત્ર પુત્રીઓ

realpatidar.com

https://archive.org/details/bk203/page/n25/mode/1up

realpatidar.com

(૬૪) પટેલ માવજી પ્રેમજી સેંગાણી
(૬૫) સૌ. બહેન રામબાઇ તે માવજી પ્રેમજીની ધર્મપત્નિ
(૬૬) ચી. ભાણજીભાઇ
(૬૭) ચી. બાઇ પાનબાઇ
(૬૮) ચી. બાઇ કાનબાઇ
(૬૯) ચી. બાઇ પુરબાઇ
} તે માવજી પ્રેમજીના પુત્ર પુત્રીઓ
(૭૦) પટેલ ખીમજી પ્રેમજી
(૭૧) માતુશ્રી માનબાઇ તે ખીમજી પ્રેમજીની માતુશ્રી
(૭૨) પટેલ વાલજી નથુ પોકાર
(૭૩) સૌ. બહેન ગોમતીબાઇ તે વાલજી નથુની ધર્મ પત્નિ
(૭૪) માતુશ્રી સોનબાઇ તે વાલજી નથુની માતુશ્રી
(૭૫) તેમના પુત્રી બાઇ મણીબાઈ
(૭૬) પટેલ રતના જશા નુખે સામાણી ગામ દયાપુરવાળા
(૭૭) સૌ. બહેન રાજબાઈ તે રતના જશાની ધર્મપત્નિ
(૭૮) ચી. રામજીભાઇ
(૭૯) ચી. બાઇ કાનબાઇ
} તે રતના જશાના પુત્ર પુત્રીઓ
(૮૦) પટેલ કાનજી ખેતા નુખે ભગત ગામ દયાપુરવાળા
(૮૧) સૌ. બહેન પાનબાઇ તે કાંનજી ખેતાની ધર્મપત્નિ
(૮૨) ચી. કરસનભાઇ
(૮૩) ચી. હંસરાજભાઇ
(૮૪) ચી. ગોપાલભાઇ
(૮૫) ચી. બાઇ લખમાબાઇ
} તે કાનજી ખેતાના પુત્ર પુત્રીઓ

See Page 18 for the year - Kutchi Samvat 1988 (i.e., normal Vikram Samvat 1987)

[VSA: 05-Sep-1931]

ઉપર મુજબના ભાઇઓએ સહકુટુંબ દેહશુધ્ધિ કરાવ્યા પછી તેઓએ આગળથી બંધાવી રાખેલ શ્રી સત્યનારાયણ ભગવાનનું મંદિર તેમાં શ્રીસત્યનારાયણની મુર્તીની પ્રતિષ્ટાની તૈયારી કરવા માંડી તે શ્રાવણવિદ ૮–જન્માષ્ટમીના દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનની મુર્તીની પ્રતિષ્ટાના પ્રસંગે કંકોત્રીઓ મોકલાવ્યા મુજબ બહાર ગામથી આપણી જ્ઞાતિના તેમજ અન્ય જ્ઞાતિના સજ્જનો હાજર થયા હતા. ગામ લખપતથી અમલદારોમાં મેં. રા. રા. વહીવટદાર સાહેબ પ્રાણજીવન પુરૂસોતમભાઈ સહકુટુંબ. તથા રા. રા. રવીશંકરભાઇ આમરજી અવલકારકુન તથા રા. રા. રવિશંકરભાઇ નંદરામ તથા મે. રા. રા. ફોજદારસાહેબ દલપતરામભાઇ તથા મે. રા. રા. દાકતર સાહેબ ગોવર્ધનદાસ બાપુભાઇ સહકુટુંબ તથા પોલીસના હવાલદાર મે. અબદુલાભાઇ સીવાય પટાવાળા તથા વકીલ સાહેબ રા. રા. નથુભાઇ બોર્ડીંગના માસ્તર સાહેબ શીવજીભાઇ પેરાજ પાંચ વિદ્યાર્થી–વોલન્ટીઅરો સાથે પધાર્યા હતા તે સીવાય ગામશ્રી વીરાણી. નખત્રાણા. રવાપુર, પાનેલી, દયાપુર, ગડુલી, અકરી, વિગેરે ગામોના જ્ઞાતિ ભાઇઓએ ખાઉત્સાહથી આ કામમાં ભાગ લેવાને આવ્યા હતા.

શ્રી સત્યનારાયણ ભગવાનની મુર્તી પધરાવતી વખતે બહાર ગામના માણસોની સંખ્યા લગભગ ૫૦૦થી૬૦૦ની મળી હતી તે વખતે મદિરના નીભાવાર્થે ભેટ તરીકે કુલકોરી ૧૬૦૦ થઇ હતી જે ગણાજ આનંદથી મંદિરના ફંડમાં જમા રાખવામાં આવી હતી. તે બાદ ભોજન વગેરેનો લ્હાવો લઇ સર્વ ભાઇઓએ વિદાય લીધી હતી

realpatidar.com

https://archive.org/details/bk203/page/n26/mode/1up

realpatidar.com

યુવાનોને હાકલ

અંધ શ્રધ્ધાના અમાપ સાગરમાં ડુબકી ખાતા ઓ વીરો ! તમારા વીરત્વના શૌર્યને જગતના ચરણમાં ધરો. આજુબાજુનાં સગાંવહાલાંની શેહમાં દબાઇ તમારા જોરદાર અંતરાત્માને ખુબ રોક્યો, ઘણા દિવસ એ વડીલોની આજ્ઞા પાળી, તમે તમારી જીજ્ઞાસાને મારી, અનઇચ્છાએ પાખંડી પીરાણાપંથને ઉત્તેજન આપ્યા કર્યું. પરંતુ હવે જમાનો ડરવાનો કે સંતાવવાનો નથી. મંડળની હાકલને સાથ આપી જ્ઞાતિ માટે તમારાથી યુવત્વને શોભે તેવું કાંઇ કરવાનો છે.

ગોર બ્રહ્મા તે ઇમામશાહ, વિષ્ણુ તે નરઅલી મહમદશાહ, મહેશ તે દાદો આદમ, અને આદ્ય શકિતને બીબી ફાતમાનું પદ આપી આજ દિવસ સુધી તમારા પાસેથી તમારા ભોળપણનો લાભલઇ તમને ખુબ ચુસ્યા મુસલમાન હોઇ હિંદુઓનો વેષ પહેરી ધર્મ બોધ આપ્યો. પણ હવે જમાનાને અનુસરીને એ બોધ નકામો જાણી તમે તમારા સ્વધર્મ ઓળખીને તત્કાળ તિલાંજલી આપવાને કમર કસી તૈયાર થાઓ. સુરવીર પુર્વજોના ઓ પનોતા પુત્રો ! પાંચસો વરસ પહેલાનાં પુર્વજોના કાર્ય તરફ ઘડીભર જુઓ કે તેઓ કેવા ભડવીર હતા. અને કેવો નિર્મળ ધર્મ પાળી પોતાની માનવ જીવનની ફરજ અદા કરતા હતા. તેનું અનુકરણ કરો. હાલમાં જેવી રીતે આપણને પીરાણા ધર્મ પાળવાની ફરજ આપણા વડીલો પાડે છે, તેવીજ રીતે તે ધર્મમાં સડો, અનાચાર કે દાંભીકપણું તે જોવાનો અને કાઢવાનો પણ પુરેપુરો આપણને હકક છે. આપણા આજના યુવાનોને એવું શિક્ષણ મળે છે કે પીરાણાપંથી સૈયદ, કાકાઓની નીંદા ન કરવી, જુનું લોપી નવું ન કરવું પરંતુ બન્ધુઓ ! એ કહેવાતા ધર્માચાર્યો, પાખંડી પીરાણા ધર્મ. અને વ્યભીચારી વંઠેલા બગલા ભકતોના અનાચારોની નીંદા ન કરવી, એમ માની પુરેપૂરૂં જાણવા છતાં ઢાંકપછેડો કરી પાપના ભાગીદાર બનવું એમાં શું પુણ્ય છે? એ પાપી પુરૂષો અને પાખંડીપંથ આપણને બહુજ નુકશાન કરતા છે આપણી અંધશ્રધ્ધાએ આપણી જ્ઞાતિને કેટલી મજબુત બેડીઓથી બાંધી લીધી છે. તેના સંબંધમાં એકાદ બે દાખલા આપણા યુવાનોનાજ આપીશું તો તે અસ્થાને નહિજ ગણાય.

એકાદ વર્ષ ઉપર કેટલાક યુવાનોને પોતાનું સ્વરૂપ સમજાયાથી વૈદિક ધર્મ અનુસાર નિત્યકર્મ કરવા માડયું, જેમા તેઓને યજ્ઞોપવિત ધારણ કરવા ઉચિત જણાતાં પીરાણાના કાર્યમાં આગેવાની ભર્યો ભાગ લેતા તેમજ ગેઢેરાઈની ઉમેદવારીમાં કામ કરનાર રવાપુરવાળા માવજી વીરજી નાકરાણીના સપુત પુત્ર ભાઇ ખીમજી માવજી તેમજ હડુડ પીરાણાપંથીના ધામરૂપ ગામ ખોંભડીમાં ભકત નામથી પ્રખ્યાત થયેલ બગભકત ખીમાના પૌત્ર ભાઇ જેઠા રામજી તથા કરાચીમાં પીરાણા પંથીઓના આગેવાન વીરજી મુલજી વાડીઆ ના ભત્રીજાભાઇ મનજી કેશરા વાડીઆ વીગેરે, ભાઇઓએ યજ્ઞોપવિત ધારણ કરી, તેથી પીરાણાના લાણુ ખાઉ ભાઇઓના હાંજા ગગડી ગયાં, અને તેઓને પીરાણાની નીંદા દેખાણી જેથી ભાઇ ખીમજી માવજીની જનોઇને ઉતારવાની તેના મોટાભાઇ મેગજી માવજીને જનોઇ વિરૂધ્ધ ઉશ્કેરણી કરવા માટે રાત્રી દિવસ પાછળ પડયા. પણ મેગજી ભાઈ મુઝાણા કે જનોઇ કીયે પ્રકારે ઉતરાવવી, કારણ કે ખીમજીભાઈની મકમતા સામે તેઓ જરા પણ બોલી શકે તેમ હતું નહિ તેથી આખરે કંટાળીને તેઓએ ઘરમાંથી ખીમજીને કાઢી મુકવાનો પ્રોગ્રામ રચ્યો. પણ ખીમજી તેમ નીકલે તેવો હીજડો નહોતો, તેથી બળાત્કારથી જનોઇ ઉતરાવવી એવું ઠરાવ્યું, તેમા પણ તેઓ ન ફાવ્યા તેથી અંતે તેમના વેવાઇ માવજી રૈયા ભાદાણી ગામ નાગવીરી વાળાનેજ શુર ચડયું, અને આખરે જેટલી હતી તેટલી હીંમત ભેળી કરીને જનોઇ તોડી. શાબાશ છે ભાઇ માવજી તમોને કે રાક્ષસી સત્તા વાપરતાં તમે જરાએ ન અચકાયા જાણે તમો તો અલાઉદ્દીનના અવતારજ નહો. તેમ વળી બીજા ભાઇ મનજી કેશરા ખોંભડી વારાની જનોઇ પણ ઓરંગઝેબના અવતાર સમા કોઇ અંધ શ્રધ્ધાળુએ રાત્રે કપટથી કાપી લીધી પરંતુ ધન્ય છે અમારા એ યુવાનોને કે તેઓએ આ બધા જુલમ ઠંડે કલેજે સહી લીધો છે અને જનોઇઓ ઉતારનારને

realpatidar.com

https://archive.org/details/bk203/page/n27/mode/1up

realpatidar.com

એક શબ્દ સરખો પણ કહ્યો નહિ અને વળી પાછું પોતાનું કામ શરૂ કર્યું પરંતુ અય યુવાનો! આવો જહાંગીરી જુલમ સાંખી લેવો એ યુવાનોનો ધર્મ નથી પરંતુ શાન્તિથી જુલમને સામે થવામાંજ ધર્મ છે. યુવાનને બેસી રહેવું ઉચીત નથી પણ ફરીથી યત્ન કરવો એ એની ફરજ છે.

આપણા જ્ઞાતિ ભાઇઓ રામાયણ, મહાભારત, ગીતાજી જેવા પવિત્ર શાસ્ત્રોના બદલે નુરનામાં, બાજનામાં, જીન્નતનામાં અને દશ અવતારો જે હિન્દુધર્મનું અપમાન કરનાર કીસા કહાણીઓ તે પણ હિન્દુ ધર્મના દુશમન સૈયદોના બનાવેલ હોય (જેવા સૈયદ બાવા સાહેબ હાલમાં બનાવે છે) તે ઘણી રાજીખુશીથી પણ ભોળપણે વાંચે છે અને તેનાજ બનાવેલાં દુલદુલ ઘોડો બુરાખ વીગેરેનાં દર્શન કરે છે પોતે ઉંચ વર્ણના હિન્દુ છે તે જાણે છે છતાં પણ સૈયદો, અને આપણી જ્ઞાતિમાંથી ભાગી વટલી સાધુ બનેલા કાકાઓ અને તેમનાજ એજંટ ભટકેલ ભગતડાઓના અપવિત્ર હાથેથી દુવાઓ ફાતીઆઓ પડી ફુંક મારી અપવિત્ર કરેલા પદાર્થો ખાવામાં જરાપણ વાંધો લેતા નથી ને શરમાતા પણ નથી એ જાણ્યા છતાં પણ અરે હે વહાલા ભાઇઓ હજી એ પીરાણાપંથને કેમ નભાવો છો તે સમજાતું નથી.

કેટલાએક પીરાણાપંથના કાંધીઆઓ પીરાણાપંથ અર્ધદગ્ધ પાખંડી પંથ છે. એવું કહેનારને મારવા ઉઠે છે, પણ તેઓનેજ કોઇ મુમના મતીઆ કે ઇશમાઇલી કહે તો તેઓ જરાય શરમાતા નથી જેમને સ્વમાનની જરાય લાગણી નથી તેવાઓને હવેથી તમારે કહી દેવું જોઇએ કે તમારૂં પીરાણા પંથનું રગસીયું ગાડુ તમારા જેવા બળદોથી હવે વધારે દિવસ સુધી ચાલે તેમ નથી કારણ કે યુવાનો જાગૃત થતા જાય છે, માટે અય પીરાણાપંથના પ્રપંચમાં ફસાયલા બંધુઓ! આપણા પૂર્વજો

સ્વધર્મને રક્ષવા, તલવાર કરમાં ઝાલતા, સમરાંગણે અરી સૈન્યને, શુરવીરતા દેખાડતા ;
નિશ્ચય અડગને ટેક, સાચી ધર્મમાંએ રાખતા, સ્વધર્મ માટે હર્ષથી, માથુ ઉતારી આપતા.

તેનાજ આ સંતાનો! તમો ભલે એ પાપાત્માઓના પાપને દબાવી પ.પના ભાગીદાર બનો, ભલે તમારા પુર્વજોની કીર્તિ ઉપર પાણી ફેરવો પણ આ ઉગતા યુવાનોના રસ્તા શામાટે બંધ કરો છો, તમારા એ દાબથી હવે એ યુવાનો નહિ દબાય, કે નહી બીબાય તે તમારે નક્કી માની લેવું

[પીરાણાપંથમાંથી મુક્ત થવા ઇચ્છનારા અય યુવાનો! હવે તો મસ્તક ઉચું કરી, કમર કસી, તેમજ નીડર બની પીરાણાપંથના કાંધીઓને પડકાર કરી કહી દયો કે અમો ઘણા દિવસ સુધી તમારી શેહમાં દબાઇ પાયમાલ થયા તે અમે સહ્યું, પણ હવેથી જેઓને એ પાખંડી પીરાણાપંથમાંથી છુટા થવું હોય તેઓને અટકાવી તેમના હૃદયને આઘાત પોચાડવાનું દુષ્કૃત્ય ન કરો.]

યુવાનો! સત્ય માટે મરી ફીટવું એજ ધર્મ છે. આ પીરાણાપંથ સામેનો સંગ્રામ સત્ય સીલો છે; એમાં પાખંડીઓનું કામ નથી. એ પાખંડીઓનો પાપનો ઘડો ક્યારનોએ ફુટી ગયો છે, હવે તો એ પંથના સંચાલકોને છુટથી સત્ય હકીકત કહેવાની હીમત હોવી જોઇએ તેવી હીમત આવવા માટે આવો આ મંડળમાં કે જેથી તમો એ પાખંડીઓના સામા ખુલ્લી છાતીએ ઉભવાની હીમત કરી શકો. પ્રભુ તમને સદ બુધ્ધિ આપે કે ખરૂં ખોટું પારખી શકો એજ અભ્યર્થના છે.

લી૦ રતનસી શીવજી પટેલ.

realpatidar.com

https://archive.org/details/bk203/page/n28/mode/1up

realpatidar.com

realpatidar.com

https://archive.org/details/bk203/page/n29/mode/1up

realpatidar.com

આ રીપોર્ટ કરાચીના વોટરકોર્સ રોડપર આવેલ "દુર્ગા પ્રીન્ટીંગ પ્રેસ" માં
છોટાલાલ કાનજી મહેતાએ છાપ્યો.

realpatidar.com